

સંબંધોનો દાયકો પૂરો થતા વડાપ્રધાનનું સંબોધન

અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ. ચૂંટણી પંચ બપોરે ૩ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. આ ઉપરાંત ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્ર પ્રદેશમાં યોજનારી વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી. લોકસભાની ચૂંટણી એપ્રિલના મધ્યથી શરૂ થશે અને મેના અંત સુધી અનેક તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીની તારીખોની જાહેરાતના એક દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક પત્ર દ્વારા દેશને સંદેશ આપ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, "આપણા સંબંધોને એક દાયકા પૂર્ણ થયાં. મને વિશ્વાસ છે કે અમને તમારું સમર્થન મળતું રહેશે. અમે રાષ્ટ્ર નિર્માણ માટે સખત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છે." પત્રની શરૂઆત કરતા પીએમ મોદીએ કહ્યું, "મારા પ્રિય પરિવારના સભ્યો, તમે અને હું સાથે મળીને એક દાયકા પૂર્ણ કરવાની અણીએ છીએ. ૧૪૦ કરોડ ભારતીયોનો વિશ્વાસ અને સમર્થન મને પ્રેરણા આપે છે. લોકોના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, તે છેલ્લા ૧૦ વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી સિદ્ધિ છે. આ પરિવર્તનકારી પરિણામો ગરીબો, બેઠૂતો, યુવાનો અને મહિલાઓના જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ સરકાર દ્વારા કરવામાં આવેલા નિષ્ઠાવાન પ્રયાસોનું પરિણામ છે."



ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો પર ચૂંટણી થશે. આ સાથે રાજ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતમાં સાતમી મેએ લોકસભા ચૂંટણીનું મતદાન થશે, સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેએ યોજાશે. ૪ કોંગ્રેસ, ૧ આપ અને ૧ અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને આ નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યો છે. છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમની બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા ચૂંટણીમાં આ છ બેઠક પરથી પેટાચૂંટણી થશે. ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરમાં પેટાચૂંટણી યોજાશે. જો કે, વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. લોકસભાની સાથે સાથે ગુજરાતની ૨૬ બેઠકો પર સાતમી મેએ મતદાન થશે. ત્રીજા તબક્કામાં યોજાશે ગુજરાતનું મતદાન યોજાશે, ગુજરાત સહિત તમામની મતગણતરી ચોથી જૂનના રોજ થશે. વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ સાતમી મેના રોજ થશે. ૧૮૨ સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ જીત મેળવતા ૧૫૬ બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કોંગ્રેસને ૧૭, આમ આદમી પાર્ટીને ૫, અપક્ષના ૩ અને સમાજવાદી પાર્ટીની ૧ બેઠક પર જીત મળી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં છ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપ ના ૧૫૬, કોંગ્રેસ ૧૩, આમ આદમી પાર્ટી ૪, અપક્ષ ૨ અને સપાના ૧ ધારાસભ્ય છે. જેને લઈને આ ખાલી પડેલી છ વિધાનસભા બેઠકો માટે લોકસભા ચૂંટણીની સાથે જ

રાજ્ય વિધાનસભાની ખાલી પાંચ બેઠકો પર ચૂંટણી જાહેર

૪ કોંગ્રેસ, ૧ આપ અને ૧ અપક્ષના નેતાએ પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાશે

ગુજરાતમાં લોકસભાની સાથે જ પાંચ વિધાનસભા બેઠકની સાતમી મેએ ચૂંટણી

પેટાચૂંટણી યોજાશે. ત્યારે આ બેઠકો પોતાના નામે કરવા રાજકીય પક્ષોએ કમર કસવી પડે તેમ છે. કઈ કઈ બેઠક પરથી કોણે આખા રાજીનામું? ૧. માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. ૨. ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. ૩. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે. ચાવડાનું રાજીનામું આપ્યું હતું. ૪. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોહવાડિયાનું રાજીનામું આપ્યું હતું. ૫. વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ૬. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

ચેનલ નાર્દન નેટવર્ક ગુજરાત અમદાવાદથી પ્રકાશિત થતું ગુજરાતી દૈનિક

ઓફિસ : ૩૧૫, સુપર પ્લાઝા, સંદેશ પ્રેસ રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. ટેલિફોન : ૦૭૯-૨૬૭૬૫૭૩૩ e-mail : cnngujarat@yahoo.com, cnngujarat@gmail.com RNI Reg. No. GUJGUJ/2009/28886

લોકો અને રાજકીય પક્ષોની આતુરતાનો અંત આવ્યો | ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ, દેશમાં ૯૭ કરોડ મતદારો લોકસભાની ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી, ૪ જૂને પરિણામ

૧ નવી દિલ્હી, તા. ૧૬ | છેલ્લા ઘણા સમયથી જોવાતી રાહનો હવે અંત થયો. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી ૨૦૨૪નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત ૧૯ એપ્રિલથી થશે અને ૧ જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો ૪ જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી ઈન્ડિયાગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતમાં સૌથી મહત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં ૭ મેના રોજ લોકસભાનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની ૨૬ બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ ૫ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે. આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા ૨૦૦૪માં ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૯માં ૨ માર્ચ અને ૨૦૧૪માં પાંચ માર્ચ અને ૨૦૧૯માં ૧૦ માર્ચ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિતા લાગુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન ઈન્ડિયાવચ્ચે જોરદાર જંગ જામવાનો છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે 'અખ કી બાર ૪૦૦ પાર' નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે.

- કિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.
- કાગળનો ઉપયોગ લઘુત્તમ કરવામાં આવશે.
- ૮૫ વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે.
- બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી.
- દરેક ભૂથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે.
- ૧૨ રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ.
- ૮૨ લાખ મતદારો ૮૫ વર્ષથી ઉપરના, જ્યારે ૨.૩૮ લાખ મતદાર ૧૦૦ વર્ષથી ઉપરના.
- આ વખતે ૧.૮૨ કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.
- ૧૦.૫ લાખ પોલિંગ બૂથ હશે અને કુલ ૧.૫ કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે.
- આ વખતે દેશમાં ૯૭ કરોડ મતદારો.
- ૯૬.૮૮ કરોડ.
- પુરુષ મતદારો ૪૯.૭૨ કરોડ.
- મહિલા મતદારો ૪૭.૧૫ કરોડ.
- થર્ડ જેન્ડર ૪૮૦૪૪

- ૧૮૪ કરોડ.
- ૨૦ થી ૨૯ ઓછી વયના મતદારો.
- ૧૯.૭૪ કરોડ.
- ૮૮.૩૫ લાખ.
- ૮૦થી વધુ વયના મતદારો
- ૧.૮૫ કરોડ.
- ૧૦૦થી વધુ વયના મતદારો
- ૨.૩૮ લાખ.
- ૨૦૧૯ VS ૨૦૨૪ના મતદારોના ડેટાની તુલના
- ૨૦૧૯માં ૮૯.૬ કરોડ.
- ૨૦૨૪માં ૯૬.૮ કરોડ.
- ૨૦૧૯માં ૪૬.૫ કરોડ.
- ૨૦૨૪માં ૪૯.૭ કરોડ.
- ૨૦૧૯માં ૪૩.૧ કરોડ.
- ૨૦૨૪માં ૪૭.૧ કરોડ.
- ૯૪૮.
- આ ચૂંટણીમાં લગભગ ૯૭ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. દેશભરમાં ૧૨ લાખથી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. પંચના જણાવ્યાનુસાર, મતદાર યાદીમાં ૧૮ થી ૨૯ વર્ષની વયજૂથના બે કરોડ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ના કામકાજમાં અનિયમિતતાનો આક્ષેપ કરતી અરજી પર વિચાર કરવાનો ઈકાર કરી દીધો હતો. જસ્ટિસ સંજય ભટ્ટની બેન્ચે કહ્યું કે, આ કોર્ટે પહેલાથી જ ઘણી વખત તેની તપાસ કરી છે અને ઈવીએમ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિચાર કર્યો છે. બેન્ચે અરજદારને પૂછ્યું કે, અમે કેટલી અરજીઓ પર વિચાર કરીશું? હાલમાં જ અમે વીવીપેટસંબંધિત અરજી પર વિચાર કર્યો હતો. અમે ધારણાઓ પર ચાલી ન શકીએ. દરેક પદ્ધતિના પોતાના હકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓ હોય છે. અમે આર્ટિકલ ૩૨ હેઠળ આના પર વિચાર કરી શકતા નથી. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે કોર્ટે ૧૦થી વધુ વખત આ મુદ્દાની તપાસ કરી છે.



ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો ગુજરાતમાં સાત મેએ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે

ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન ૭ તબક્કામાં થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત ૧૯ એપ્રિલથી થશે અને ૧ જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતમાં ૨૬ લોકસભાની બેઠકો પર ૭ મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. એટલે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનું સમાપન યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. પેટાચૂંટણી માટે મતદાન ૭ મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે. ગુજરાતમાં ૨૬ લોકસભા બેઠકો પર મતદાન પૂરું થયા બાદ ૪ જૂનના રોજ પરિણામ જાહેર કરાશે. ગુજરાત પીએમ મોદી અને ભાજપનું ગઠ મનાય છે. એટલા માટે આખા દેશની નજર ગુજરાતની ચૂંટણીઓ પર રહેશે ત્યારે અહીં ૫ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે જેની તારીખ ૭ મે જ નક્કી કરવામાં આવી છે. ૧૨ એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ રહેશે. જ્યારે ૨૦ એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો ૨૨ એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઈ શકશે. છેવટે ૭ મેના રોજ મતદાન થશે અને મતગણતરી ૪ જૂનના રોજ કરાશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર થઈ જશે.

ચૂંટણી માટે ૫૫ લાખથી વધુ ઈવીએમનો ઉપયોગ થશે દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં દોઢ કરોડ અધિકારીઓ જોડાશે

ભારતના ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખો સાથેની જાહેરાત કરતાં કહ્યું કે ભારતમાં ચૂંટણી માટે ૫૫ લાખથી વધુ ઈવીએમશીનોનો ઉપયોગ કરવામાં આવશે અને દોઢ કરોડ અધિકારીઓ આ કામમાં જોડાશે. તમામ પોલિંગ બૂથ પર પીવાનું પાણી, ટોઈલેટ અને વીલેયરની પાયાની સુવિધાઓ આપવામાં આવશે. મતદાનની ટકાવારી વધારવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. ૮૫ વર્ષથી વધુ વયના મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે, તેઓ ઘરેથી પણ વોટિંગ કરી શકશે. ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિશદમાં વાત કરતાં કહ્યું કે, અમે ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો અને વિકલાંગ મતદારોના મત તેમના ઘરે જઈને લઈશું. અને તેના નોમિનેશન પહેલા તેમના ઘરે ફોર્મ પહોંચાડવામાં આવશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં એક સાથે લાગુ કરવામાં આવશે. છેલ્લી ચૂંટણીની તારીખોની જાહેરાત કરતી વખતે તત્કાલિન કમિશનર અશોક લવાસાએ એ બાબતોના સંકેત આપ્યા હતા કે, તારીખો નક્કી કરવામાં કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. ૨૦૧૯ની તારીખોનું એલાન કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે ચૂંટણીની તારીખો માટે પરીક્ષાઓની તારીખો, તહેવારો, પાકની મોસમ અને હવામાન ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિશદમાં વાત કરતાં કહ્યું કે, અમે ૮૫ વર્ષથી વધુ વય ધરાવતા તમામ મતદારો અને વિકલાંગ મતદારોના મત તેમના

ન્યુઝ બોક્સ

આગામી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

। (એજન્સી) અમદાવાદ, તા. ૧૬ । ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી આગામી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણમય ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. ૧૮મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે, જે આગામી ૯૦ દિવસ એટલે કે, ૧૫મી જૂન સુધી ચાલુ રહેશે. જેનો લાભ અંદાજે ૩.૨૦ લાખ ખેડૂતોને થશે. મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૧૭૩૪ કરોડની કિંમતની ૨,૪૫,૭૧૦ મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત ૧૭૬૫ કરોડની કિંમતના ૩,૨૪,૫૩૦ મે. ટન ચણા અને ૮૫૩ કરોડની કિંમતના ૧,૫૦,૮૦૫ મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું કે, રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે ૧૪૦ ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે ૧૮૭ ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે.

અમદાવાદ શહેરને સૌથી સ્વચ્છ શહેર બનાવવા કન્સલ્ટિંગ કંપની હાયર કરાઈ

એક કન્સલ્ટિંગ કંપની શહેરને મદદ કરશે જેથી ૨૦૨૬ સુધીમાં અમદાવાદમાં સ્વચ્છતાની સ્થિતિ સુધરશે તેમ લાગે છે

। (એજન્સી) અમદાવાદ, તા. ૧૬ । અમદાવાદમાં સોલિડ વેસ્ટ કલેક્શનની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે જેના કારણે સ્વચ્છ શહેરોના વિસ્તરમાં અમદાવાદ પાછળ રહી ગયું છે. હવે અમદાવાદને પણ ચમકાવવા માટે એક કન્સલ્ટિંગ ફર્મને હાયર કરવામાં આવી છે જે શહેરને સૌથી સ્વચ્છ કેવી રીતે બનાવવું તેની સલાહ આપશે. અમદાવાદની વસતી વધતી જાય છે તેમ તેમ કચરાનો ઢગલો પણ મોટો થતો જાય છે. દર વર્ષે વેસ્ટ કલેક્શન માટે ૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. છતાં સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ ટેન શહેરોમાં અમદાવાદનો સમાવેશ થતો નથી. હવે એક કન્સલ્ટિંગ કંપની શહેરને મદદ કરશે જેથી ૨૦૨૬ સુધીમાં અમદાવાદમાં સ્વચ્છતાની સ્થિતિ સુધરશે તેમ લાગે છે. AMCની કન્સલ્ટિંગ કમિટીએ એક પ્રાઈવેટ ફર્મ 'બ્રાયન અબોવ ઈન્ફોસોલ્વ'ને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ માટે કુલ ૩.૭૫ કરોડની ફી ચૂકવશે. એટલે કે એક વર્ષની ફી રૂ. ૧.૨૫ કરોડ નક્કી થઈ છે. જોકે, વર્ષ ૨૦૨૬ સુધીમાં અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર ન બની શકે તો આ ફર્મને કોઈ પેનલ્ટી કરવાની કે તેની ફીમાં કટ કરવાની કોઈ જોગવાઈ નથી. આ કોન્ટ્રાક્ટ હેઠળ કન્સલ્ટિંગ કંપની વર્ષ ૨૦૨૬ના સ્વચ્છ



સર્વેક્ષણ સુધી ૪ રિસોર્સ પર્સન આપશે. તેના દ્વારા અમદાવાદ દરેક માપદંડમાં પાર ઉતરે તેવા પગલાં લેવાશે. આમ તો અમદાવાદ સૌથી સ્વચ્છ બને તે જોવાની જવાબદારી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની છે. તાજેતરમાં વર્ષ ૨૦૨૩ના સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા આલ્યા તેમાં સુરત અને ઈન્દોર પ્રથમ સ્થાન પર હતા જ્યારે અમદાવાદ છેક ૧૫મા ક્રમ પર હતું. આ સર્વેક્ષણમાં એક લાખથી વધુ વસતી ધરાવતા ૪૪૭૭ શહેરોએ ભાગ લીધો હતો. વર્ષ ૨૦૨૨ના સર્વેક્ષણમાં અમદાવાદ ૧૮મા ક્રમે હતું. અમદાવાદને ખુલ્લામાં શોચથી મુક્ત શહેરનું પણ સર્ટિફિકેટ મળ્યું છે. સ્વચ્છતામાં અમદાવાદને આગળ લાવવા માટે ડેવલપમેન્ટ માટે પણ ત્રણ કન્સલ્ટન્ટને હાયર

કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે વર્ષ ૨૦૨૧ સુધીના ડેવલપમેન્ટની યોજના તૈયાર કરવામાં આવશે. ૨૦૨૬માં અમદાવાદ ઓલિમ્પિક્સ માટે બિડ કરવાનું હોવાથી આગામી દાયકાને ધ્યાનમાં રાખીને શહેરનો વિકાસ કરવામાં આવશે. તેના માટે ઓડા એન્કર એજન્સી રહેશે અને બીજી એજન્સીઓ છ મહિનામાં ડેવલપમેન્ટ પ્લાન વિકસાવશે. ગુજરાત સરકારે HCP, યુકે સ્થિત કંપની અરુપ ઈન્ડિયા પ્રા. લિમિટેડ અને ડેન્માર્ક સ્થિત ગેહલ આર્કિટેક્ટ્સને કન્સલ્ટન્ટ તરીકે સિલેક્ટ કરી છે. તેઓ શહેરમાં ભવિષ્યની જરૂરિયાતોને લઈને ટ્રાન્સપોર્ટેશન, એનર્જી, પર્યાવરણ, ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બ્લૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રાદેશિક અને લોકલ ઈકોનોમી, બ્યુટિફિકેશન, ફિઝિકલ અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત તેઓ સસ્તેનેબલ સિટી ડેવલપમેન્ટ માટે એક્શન પ્લાન પણ તૈયાર કરશે. અમદાવાદને વોટર સરવ્લસ સિટી પણ જાહેર કરવામાં આવ્યું છે. એએમસીએ ફાઈવ સ્ટાર સર્ટિફિકેશન માટે અરજી કરી હતી પરંતુ શહેરને માત્ર ૩ સ્ટાર મળ્યા હતા. ૩ઈલી વેસ્ટના પ્રોસેસિંગ અને બાયોમાઈનિંગમાં અમદાવાદ પાછળ રહી ગયું હોવાથી સ્વચ્છતા રેટિંગને અસર થઈ છે.

વ્યાજખોરોએ પૈસા માટે ઘોળા દિવસે ૨ મહિલા સહિત બાળકોને ઉઠાવી લીધા

। (એજન્સી) સુરેન્દ્રનગર, તા. ૧૬ । સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે વ્યાજે આપેલા પૈસાની ઉધરાણીને લઈ વ્યાજખોરો દ્વારા બાળકોનું અપહરણ કર્યું હતું. જે બાબતે પોલીસને જાણ કરતા ચોટીલા પોલીસે ગણતરીમાં કલાકોમાં બંને શશ્નોને ઝડપી પાડ્યા હતા. રાજ્યમાં ફરી વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરો દ્વારા હવે હદ વટાવી છે.

પૈસાની જરૂરીયાત હોઈ યુવક દ્વારા વ્યાજે પૈસા લીધા હતા. જે બાદ વ્યાજખોર દ્વારા અવાર નવા રૂપિયાની ઉધરાણી કરવા માટે બાળકોનું અપહરણ કર્યું હતું. ત્રણ શશ્નોએ ૨ મહિલા અને ૨ બાળકોનું અપહરણ કર્યું હતું સુરેઈ ગામે વ્યાજે આપેલ પૈસાની ઉધરાણી બાબતે મહિલા તેમજ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. વ્યાજખોરોનો ત્રાસથી પરિવારજનો કંટાળી અન્ય જગ્યાએ રહેવા પહોંચ્યો હતો. ત્યારે પરિવારજનો શાંતિથી વિંછીયા તાલુકામાં રૂપ

વટીનો પરિવાર સુરેઈ ગામે સંબંધીને ત્યાં રહેવા આવ્યો હતો. જે બાબતની જાણ વ્યાજખોરોને થતા વ્યાજખોરો દ્વારા રાત્રીના સુમારે ત્યાં પહોંચી ત્રણ લોકોનું અપહરણ કરી રાત્રે ઘરે મૂકી ગયા હતા. વ્યાજખોરો દ્વારા વ્યાજખોરો દ્વારા ૨ મહિલાઓ તેમજ બાળકોનું અપહરણ કર્યું હતું. જે બાબતે પરિવારજનોએ અપહરણકારો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ચોટીલા પોલીસે ગણતરીમાં કલાકોમાં જ બંને શશ્નોને ઝડપી પાડ્યા હતા.

પોતાની દુકાનમાં જ આપઘાત કર્યો સુરતના કતારગામ વિસ્તારમાં પાનના ગલ્લાવાળાએ આપઘાત કરી લીધો

। (એજન્સી) સુરત, તા. ૧૬ । સુરતના કતારગામ વિસ્તારમાં એક પાનના ગલ્લાવાળાએ આપઘાત કરી લીધો છે. આપઘાત પહેલા પાનના ગલ્લાવાળાએ પોતે કયા કારણોસર આપઘાત કર્યું તે પણ જણાવ્યું છે. એક વ્યક્તિએ તેની પત્નીના નગ્ન ફોટો વાયરલ કરી દેતા આ પગલું ભર્યું હોવાનું તેણે વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે. તેણે પોતાની દુકાનમાં જ આપઘાત કરી લેતા ચક્રચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં દિલીપભાઈ (નામ બદલવામાં આવ્યું છે) નામના શખ્સ પોતાનો પાનનો ગલ્લો ધરાવતા હતા. બુધવારના સાંજને સમયે તેમણે દિવસભર ગલ્લો ચાલુ રાખ્યો હતો. અને બાદમાં દુકાન બંધ કરીને દુકાનમાં છૂટના લોખંડના હુક સાથે દોરી બાંધીને આપઘાત કર્યો હતો. આ બનાવથી ચોક બજાર વિસ્તારની પોલીસ દોડતી થઈ હતી. પોલીસ તપાસ કરતા દિલીપભાઈ પાસેથી એક વીડિયો મળી આવ્યો હતો. જેમાં તેમણે આપઘાતનું કારણ જણાવ્યું હતું. એક શખ્સે પત્નીના નગ્ન ફોટો વાયરલ કરી દેતા પાનના ગલ્લાવાળાએ આપઘાત કર્યો

હોવાનો તેમણે વીડિયોમાં જણાવ્યું હતું. તેમજ વીડિયોમાં પોલીસ પાસે ન્યાયની માંગ કરી હતી. ચોક બજાર પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દિલીપભાઈને એક પરિચિતે તેમની પત્નીનો નગ્ન ફોટો બતાવ્યો હતો, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આપઘાત પહેલાના વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, મને જેણે મરવા મજબૂર કર્યો છે તે દેશી દાડૂનો ધંધો કરે છે. તેણે મારી પત્નીને ભોળવી તેના ફોટા પાડી વાઈરલ કર્યાં. મને એક બીજા વ્યક્તિએ આ ફોટો બતાવ્યો, જેના કારણે મને આઘાત લાગ્યો અને તેના કારણે હું આ પગલું ભરું છું. પોલીસ ખાતાને વિનંતી છે કે તેને સજા આપવામાં આવે, તેણે મારી જિંદગી બચાવે કરી છે. હું અભણ છું, મને કોઈ લખતા વાંચતા આવડતું નથી, જેથી આ વીડિયો બનાવી આ પગલું ભરું છું, તમને જો ભગવાન મનમાં વસે તો તમે મારું કાર્ય કરજો. વધુમાં કહી રહ્યા છે કે, મારે એક દીકરો અને એક દીકરી છે. તેઓ નાદાન છે તેઓને કંઈ જ ખબર જ નથી, તેઓની સામે જોઈને મને ન્યાય અપાવજો

Amazon કંપની સાથે અલગ પ્રકારની છેતરપિંડીનો કીસ્સો ઓનલાઇન ટીવી શોપિંગ કરી છેતરપિંડી આચરતી ટોળકીની ધરપકડ કરવામાં આવી

પોલીસે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે

। (એજન્સી) અમદાવાદ, તા. ૧૬ । અમદાવાદમાં amazon કંપની સાથે એક અલગ પ્રકારની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં amazon કંપની ના ડીલીવરી ડિસ્ટ્રિબ્યુટર વેલેન્સ લોજિસ્ટિક પ્રાઈવેટ લિમિટેડના ઓપરેશન મેનેજર દ્વારા નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદમાં કંપની દ્વારા પોતાના જ માણસો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં વેલેન્સ લોજિસ્ટિકમાં કામ કરતા ડીલેવરી બોય, ડ્રાઈવર, પીએ સહિત નવ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. જ્યારે તપાસમાં વધુ બે લોકોના નામ ખુલ્લા પોલીસે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી જેમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વેલેન્સ લોજિસ્ટિક દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે જેમાં પોતાના અલગ અલગ માણસો એમેઝોન એપ



દ્વારા ટીવીનો ઓર્ડર આપતા હતા, જે ઓર્ડરના આધારે એમેઝોન કંપની વેલેન્સ લોજિસ્ટિકને નવું ટીવી પેક કરી ડિલિવર માટે ઓર્ડર આપતું હતું. જે બાદ વેલેન્સ લોજિસ્ટિક કંપની માંથી નવું ટીવી લઈને ડીલેવરી મેન ડિલિવરી કરવા જતા હતા. જે સમયે નવા ટીવી નું પેકેજ ખોલી તેમાં જે તે કંપનીનું જૂનું ટીવી મૂકી નવું ટીવી પોતે રાખી લેતા હતા. ત્યારબાદ ફરીથી આ બોક્સને પેક કરી દેતા હતા. જે બાદ એમેઝોન પર

આપેલા ઓર્ડરને કેન્સલ કરી દેતા હતા અને ફરીથી આ જૂનું ટીવી કંપનીના ગોડાઉનમાં મૂકી દેતા હતા. જોકે છેલ્લા થોડા સમય થી અનેક વખત આ પ્રમાણે થતાં amazon કંપનીને શંકા જતા તેણે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર કોભાંડ સામે આવ્યું હતું. પોલીસે ત્રણ આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, નવા જુના ટીવી લે-વેચનો ધંધો કરતા મોહમ્મદ ઈમરાન તથા મોહસીન હુસેન નામના બે લોકો ડિલિવરી બોય અને અન્ય લોકોના સંપર્કમાં આવ્યા હતા. બંને લોકો પોતાની પાસે રહેલા જુના અને બંધ ટીવી કંપનીના માણસોને આપતા હતા અને નવું ટીવી પોતે ખરીદી લેતા હતા. અત્યાર સુધીમાં કંપનીના માણસો અને અન્ય લોકોએ મળીને ઓગસ્ટ ૨૦૨૩ થી ડિસેમ્બર ૨૦૨૩ ના સમયગાળામાં કુલ ૧૪૭ નવા ટીવીની જગ્યાએ જુના ટીવી રાખી ઓર્ડર કેન્સલ કરેલા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ । અમદાવાદ જિલ્લામાં કુલ ૫૪૩૨ મતદાન મથકો પર યોજાશે મતદાન જિલ્લામાં કુલ ૬૦,૩૬,૧૪૫ નોંધાયેલા મતદારો, જેમાં ૧,૦૪,૧૭૫ મતદારો કરશે પ્રથમ વખત મતદાન

ચૂંટણીની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી પ્રવીણા ડી.કે. અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરે રજૂ કરી વિગતો

। (એજન્સી) સુરત, તા. ૧૬ । લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે. અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરે જિલ્લામાં ચૂંટણી તંત્રની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે મીડિયાના માધ્યમથી વિગતો રજૂ કરી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ ૦૫ મે-૨૦૨૪ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના માટે આગામી તારીખ ૧૨ એપ્રિલ-૨૦૨૪ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લામાં કુલ- ૬૦,૩૬,૧૪૫ મતદારો નોંધાયેલા છે. જેમાં ૩૧,૩૩,૨૮૪ પુરુષ મતદારો અને ૨૯,૦૨,૮૬૧ સ્ત્રી મતદારો તથા ૨૩૯ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં ૧૮થી ૧૯ વર્ષના મતદારો-૧,૦૪,૧૭૫



છે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે. ૨૦થી ૨૯ વય જૂથના ૧૦,૯૫,૬૦૮ મતદારો છે. જ્યારે ૪૫,૦૨૨ મતદારો ૮૫ વર્ષ ઉપરના છે. ૧૨૫૯ મતદારો ૧૦૦ વર્ષ ઉપરના શતાયુ મતદારો છે અને ૩૦,૭૩૨ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં કુલ-૫૪૩૨ મતદાન મથકો છે. આ ઉપરાંત, જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત ૧૪૭, દિવ્યાંગો દ્વારા સંચાલિત ૨૧, યુવાઓ દ્વારા સંચાલિત ૨૧ મતદાન મથકો છે તથા ૨૧ ઈકો ફેન્ડલી મતદાન

મથકો અને ૨૧ મોડેલ મતદાન મથકો રહેશે. નાગરિકોની સુવિધા માટે 24*7 જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦ અને ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૯૬૬ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં ચૂંટણી અને આચારસંહિતાના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ નિયંત્રણ ટીમ, ફ્લાઈંગ સ્કવોડ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ જેવી ટીમોની રચના કરવામાં આવી આવી છે.

વોટર હેલ્પલાઇન એવિલેક્શન (VHA), cVigil, Suvidha portal, KYC જેવા અલગ અલગ પોર્ટલ અને એવિલેક્શન મતદારો અને ઉમેદવારોને અલગ અલગ સુવિધાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. cVigil એવિલેક્શન પર નોંધાયેલી આદર્શ આચારસંહિતા ભંગ અંગેની તમામ ફરિયાદોનો માત્ર ૧૦૦ મિનિટમાં નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત ચૂંટણીમાં ૮૫ વર્ષથી વધુ વયના મતદારો અને ૪૦%થી વધારે દિવ્યાંગતા ધરાવતા

મતદારો માટે ઘરેથી વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે. દિવ્યાંગ મતદારો Saksham એવિલેક્શનની મદદથી મતદાન મથકો પર સુવિધાઓ મેળવી શકશે. આ પ્રેસ કોન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી એન. સ. ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

લોકસભાની સાથે ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થશે

આંધ્ર, સિક્કીમ-અરુણાચલમાં એક, ઓડિશામાં બે તબક્કામાં મતદાન

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । દેશમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ આજે જાહેર થઈ ગઈ છે, જેમાં આંધ્રપ્રદેશમાં ૧૩ મેએ, સિક્કીમ-અરુણાચલમાં ૧૮ એપ્રિલે, ઓડિશામાં બે તબક્કામાં ૧૩ મે અને ૨૦ મેએ મતદાન યોજાશે. આ જ્યારે લોકસભાની સાથે સાથે આ ચાર રાજ્યોના વિધાનસભાના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં પૂરો થવાનો છે, તેથી આ ચારેય રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની

પણ ચૂંટણીઓ યોજાશે. આ ચૂંટણીની જાહેરાત સાથે દેશભરમાં ચૂંટણી આચાર સંહિતાનો અમલ શરૂ થઈ જશે. ત્રણ રાજ્યોમાં એક તબક્કામાં અને એક રાજ્યમાં બે તબક્કામાં યોજાશે ચૂંટણી, ૧. આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે ૧૩ મેના રોજ મતદાન યોજાશે. જેમાં ૧૮ એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૫ માર્ચ, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ ૨૮ એપ્રિલ રહેશે. ૨. સિક્કીમ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ

તબક્કામાં ૧૮ એપ્રિલે મતદાન યોજાશે, જેમાં ૨૦ એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૭ માર્ચ, જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ ૩૦ માર્ચ રહેશે. ૩. અરુણાચલ પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કામાં ૧૮ એપ્રિલે ચૂંટણી યોજાશે, જેમાં ૨૦ એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ ૨૭ માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ ૩૦ માર્ચ રહેશે. ૪. ઓડિશામાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે.

ચાર રાજ્યોમાં આ તારીખે યોજાશે લોકસભા અને વિધાનસભા ચૂંટણી

● આંધ્ર પ્રદેશ - ૧૩ મેએ મતદાન - ચોથા તબક્કામાં ● સિક્કીમ - ૧૮ એપ્રિલે મતદાન - પ્રથમ તબક્કામાં ● અરુણાચલ પ્રદેશ - ૧૮ એપ્રિલે મતદાન - પ્રથમ તબક્કામાં ● ઓડિશા - ચોથા તબક્કામાં ૧૩ મે અને પાંચમા તબક્કામાં ૨૦ મેએ મતદાન
દેશભરમાં જાહેર કરાયેલ સાત તબક્કામાંથી ચોથા અને પાંચમા તબક્કામાં રાજ્યમાં ચૂંટણી યોજાશે. આ માટે ૧૮ ચોથા તબક્કામાં ૧૮ અને પાંચમાં તબક્કા માટે ૨૬ એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન બહાર પડાશે. ચોથા તબક્કામાં ૨૫ એપ્રિલ અને પાંચમાં તબક્કામાં ૦૩ મે ચુધી ઉમેદવારી નોંધાવી શકાશે. જ્યારે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથા તબક્કામાં ૨૮ એપ્રિલ અને પાંચમાં તબક્કામાં ૦૬ મે નિર્ધારિત કરાઈ છે. ઓડિશામાં ચોથા તબક્કામાં ૧૩ મે અને પાંચમા તબક્કામાં ૨૦ મેએ ચૂંટણી યોજાશે. આંધ્ર પ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસનું શાસન છે જ્યારે આ વખતે વિપક્ષ ટીડીપીનું પલ્લુ ભારે લાગે છે. બીજીબાજુ ઓડિશામાં નવીન પટનાયકના નેતૃત્વમાં બીજેડી સતત છઠ્ઠી વખત ચૂંટણી જીતવાનો વિક્રમ સર્જે તેવી સંભાવના છે. આંધ્રપ્રદેશમાં કુલ ૧૭૫ વિધાનસભા બેઠકો, સિક્કીમમાં ૩૨ વિધાનસભા બેઠકો. અરુણાચલ પ્રદેશમાં કુલ ૬૦ બેઠકો અને ઓડિશામાં કુલ ૧૪૭ વિધાનસભા બેઠકો છે. આંધ્રમાં હાલ વાયએસઆર કોંગ્રેસની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે, તો સિક્કીમમાં એસકેએમ-ભાજપ ગઠબંધનની સરકાર છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં ભાજપ-એનપીપી ગઠબંધનની સરકાર છે, જેમાં એક અપક્ષ બેઠક પણ સામેલ છે. ઓડિશામાં બીજુ જનતા દળની સરકાર છે.

ન્યૂઝ બ્રિફ

રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપસિંહનું ભાજપમાંથી રાજીનામું



। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । લોકસભા ચૂંટણીની તારીખો હવે થોડા કલાકો બાદ જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દીધું છે. એવું માનવામાં આવે છે કે અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. અજય પ્રતાપ સિંહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર શેર કરી છે. ભાજપે મધ્યપ્રદેશની તમામ ૨૯ લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી. સીધીમાં ભાજપે રાજેશ મિશ્રાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અજય પ્રતાપ સિંહે પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું છે કે 'હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યો છું.' તેમના રાજીનામા બાદ હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સીધીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા



। (એજન્સી) હૈદરાબાદ, તા.૧૬ । લોકસભાની ચૂંટણી નજીક છે. તેનો કાર્યક્રમ આજે જાહેર પણ થવાની તૈયારી છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપ માંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના સ્ટેટ ઈન્ચાર્જ દીપા દાસ મુનશીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર પણ ટિવટર પર શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં મજબૂત સ્થિતિમાં છે, જ્યારે ભાજપ ની સ્થિતિ દક્ષિણના રાજ્યોમાં એટલી સારી નથી. આવી સ્થિતિમાં ભાજપના પૂર્વ સાંસદનું પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાવું પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બીઆરએસ અને ભાજપને હરાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી.

પુત્રને ટિકિટ ન અપાતા ભાજપના નેતા ઉશ્કેરાયા કે.એસ.ઈશ્વરપ્પા શિમોગા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે

ભાજપે ઈશ્વરપ્પાના પુત્ર કાંતેશને ટિકિટ ન આપતા પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી મેદાનમાં

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । ભાજપના વરિષ્ઠ નેતા કે એસ ઈશ્વરપ્પાએ શુક્રવારે ૧૫ માર્ચે આગામી લોકસભા ચૂંટણીમાં શિમોગા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ નિર્ણય પોતાના પુત્ર કાંતેશને હાવેરી મતવિસ્તારથી ટિકિટ ન આપવાના કારણે લીધો છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને હાવેરી બેઠકથી મેદાનમાં ઉતાર્યા છે. ઈશ્વરપ્પાએ કાંતેશને ટિકિટ ન મળવા બદલ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને ટીપ્પી ઠેરવ્યા.



ભાજપે યેદિયુરપ્પાના પુત્ર બી વાઈ રાઘવેન્દ્રને શિમોગાથી ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી એસ બંગારપ્પાની પુત્રી ગીતા શિવરાજકુમારને મેદાનમાં ઉતાર્યા છે. ગીતા કન્ઝ કિલ્મ સ્ટાર શિવરાજ કુમારના પત્ની છે. ઈશ્વરપ્પા અપક્ષ ચૂંટણી લડશે. ઈશ્વરપ્પાએ

પોતાના સમર્થકો તરફથી બોલાવાયેલી બેઠકમાં ભાજપ સામે વિરોધનું એલાન કરતા કહ્યું, હું શિમોગા લોકસભા વિસ્તારથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. કર્ણાટકમાં ભાજપને ઊભુ કરવા અને ફરી તેને મજબૂત કરવાનું ક્રેડિટ ઈશ્વરપ્પા, યેદિયુરપ્પા અને દિવંગત એચએન અનંત કુમારને આપવામાં આવે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય યેદિયુરપ્પાએ તેમના પુત્રને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું.

લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી નહીં લડે

અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડે અને બંને જગ્યાએથી જીત્યા તો પછી રાહુલે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । આગામી લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષો તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક બેઠકોની જાહેરાત થઈ રહી છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચ તારીખોની પણ જાહેરાત કરવા જઈ રહ્યું છે, ત્યારબાદ ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ તે પહેલા ગાંધી પરિવાર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવારે અમેઠી અને રાયબરેલીથી પોતાને દૂર કરી લીધા છે અને પરિવારનો



કોઈ સભ્ય આ પરંપરાગત બેઠકો પરથી આગામી ચૂંટણી લડશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના બંને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડવાનો નિર્ણય કરી દીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું માનવું છે કે જો તેઓ અમેઠી અને

વાયનાડ એમ બંને જગ્યાએથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા તો પછી તેમણે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે અને લોકોમાં ખોટો સંદેશ જશે. રાહુલનું માનવું છે કે જો તે જીતીને અમેઠી છોડી દેશે તો અમેઠીના લોકો કહેશે કે છેલ્લી વખત હાર્યા બાદ આ વખતે અમે જીતાડ્યાં તો પણ અમને છોડી ગયા. જ્યારે વાયનાડ છોડતી વખતે, ત્યાંના લોકો કહેશે કે જ્યારે તેઓ પરંપરાગત સીટ અમેઠીથી હારી ગયા હતા, ત્યારે તેઓએ મને સંસદમાં મોકલ્યા હતા.



નવી દિલ્હીમાં ઝંડેવાલન ખાતે ભારતીય આદિમ જ્ઞાતિ સેવક સંઘ (બી) ના નવીનીકૃત ઈમારતના ઉદ્ઘાટન દરમિયાન આદિજાતિ બાબતો અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણના કેન્દ્રીય મંત્રીશ્રી અર્જુન મુંડા ઉપસ્થિત રહ્યા હતાં.

ચૂંટણીની જાહેરાત પહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લિટરે રૂ.૧૫.૩નો ઘટાડો

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ભારતના લક્ષદ્વીપ ટાપુમાં, એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૧૫.૩ અને કાવારત્તી અને મિનિકોય માટે રૂ. ૫.૨ પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડો આજથી લાગુ થઈ ગયો છે. લક્ષદ્વીપના તમામ ટાપુઓમાં પેટ્રોલ ડિઝલની કિંમત હવે પેટ્રોલ માટે ૧૦૦.૭૫ રૂપિયા પ્રતિ લિટર અને ડિઝલ

માટે ૮૫.૭૧ રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલના ભાવમાં ૨ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. નિર્ણય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર કર્યા પહેલા જ લેવામાં આવ્યો છે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ મંત્રાલયએ પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડા અંગે જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આપી હતી. મંત્રાલયે કહ્યું કે લક્ષદ્વીપમાં આઈઓસીએલના ટાપુઓ કાવારત્તી, મિનિકોય, એન્ડ્રોટ અને કાલપેનીને પેટ્રોલ અને ડિઝલ સપ્લાય કરે છે.

ચૂંટણીઓની જાહેરાત સાથે આચારસંહિતા લાગુ ગડકરીની રૂ. ૧૭૦૦ કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી

। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । ચૂંટણી પંચ આજે (૧૬મી માર્ચે શનિવાર) બપોરે ૧૦ વાગ્યે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ સાથે દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ થાય છે, ત્યારે કોઈપણ વિભાગ કોઈ નવા પ્રોજેક્ટને મંજૂરી આપતું નથી. જો કંઈક જરૂરી હોય તો ચૂંટણી પંચની પરવાનગી મળ્યા બાદ તેને લીલી ઝંડી આપવામાં આવે છે. આને ધ્યાનમાં

રાખીને, શુક્રવારે રાત્રે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ઘણાં વિભાગોએ ઝડપી નિર્ણયો લીધા અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી. અહેવાલ અનુસાર, ગઈકાલે (શુક્રવાર) મોડી રાત સુધી નીતિન ગડકરીના માર્ગ પરિવહન મંત્રાલય અને એનએચએઆઈ હેઠળના વિભાગોમાં કામ ચાલુ હતું. આ દરમિયાન કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રૂ. ૧૭૦૦ કરોડના ત્રણ હાઈવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

વાનકુવરથી હીથ્રો જતા વિમાન પર વીજળી ત્રાટકી, પ્રવાસીઓ સલામત

। વાનકુવર (કેનેડા), તા.૧૬ । કુદરત સામે માનવીનું કશું ચાલતું નથી. થોડા જ સમય પહેલાં પ્રકૃતિનું એક તોડવ નૃત્ય જોવા મળ્યું. એર કેનેડાનું બોઈંગ - ૭૭૭ વિમાન, વાનકુવરથી લંડનના હીથ્રો એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું. સામાન્ય રીતે વિમાનો કેટલાક કિ.મી. કાપ્યા પછી વાહળોની ઉપર ચાલ્યું જતું હોય છે. પરંતુ તે તબક્કે તે પહોંચે તે પહેલા જ અચાનક તેની ઉપર વીજળી ત્રાટકી હતી. વિમાનમાં આશરે ૪૦૦ લોકો સવાર હતા. પરંતુ પ્રભુ કૃપાથી તે સર્વ બચી ગયા. ખરી વાત તે છે કે, વીજળી પડવાની વિમાન ઉપર



કોઈ અસર થતી જ નથી હોતી. વિમાન બનાવતી વખતે જ તેનાં બહારના લેયરને એવું બનાવેલું હોય છે કે જેથી વીજળીની કોઈ અસર ન થાય. પ્લેનનું બોડી બનાવતી વખતે પહેલા તેમાં કાર્બન મિશ્ર કરવામાં આવે છે. તે પછી સમગ્ર પ્લેનની દરેક બાજુને ત્રાંબાની પાતળી પટ્ટીથી આવૃત કરાય છે. જ્યારે વીજળી પડે ત્યારે તેમાં બેઠેલા યાત્રીઓને તેનો અવાજ જરૂર સંભળાય છે, પરંતુ ફલાઈટ ઉપર તેની

અસર થતી નથી. ઉલ્લેખનીય તે છે કે તે સમયે તે વિમાનથી સલામત અંતરે ઉડી રહેલા અન્ય વિમાનમાંથી તેનો વિડીયો લઈ શકાયો છે અને તે વાયરલ પણ થઈ શક્યો છે. જે આશરે ૧૦ લાખ લોકોએ નિહાળ્યો પણ છે. જો કે આવી ઘટના કે પહેલી વાર બની નથી. ઘણીવાર બની હોય છે. વિજ્ઞાનીઓ વિમાન પર વીજળી પડી હોવા છતાં યાત્રીઓ શા માટે બચી જાય છે તે અંગે તેવું પણ તારણ આપે છે કે વિમાનનું બોડી તો મેટાલિક મટિરિયલનું હોય. પરંતુ તેની નીચે બેડ-કન્ડક્ટર લેયર્સ હોય છે. નહીં તો બોડી ઠરે સાથે પ્રવાસીઓ ઠરી જાય.

દેશમાં લોકસભા ચૂંટણીઓની તૈયારી ખેરશોરથી શરૂ
દેશમાં કુલ ૯૬.૮૮ કરોડ મતદાતા, ૪૯.૭ કરોડ પુરુષ, ૪૭.૧ કરોડ મહિલા
૧.૪૧ મહિલા, ૧.૨૨ કરોડ પુરુષ પ્રથમવાર મતદાન કરશે



। (એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ । દેશમાં લોકસભા ચૂંટણીઓની તૈયારી ખેરશોરથી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આજે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. દેશમાં ૧૮ એપ્રિલથી સાત તબક્કામાં મતદાન યોજાશે, જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે. આ સાથે ચૂંટણી પંચે દેશમાં કુલ કેટલા મહિલા, પુરુષ અને યુવા મતદારો છે, તે પણ માહિતી આપી છે. ચૂંટણી પંચે ચૂંટણીમાં રજીસ્ટર્ડ મતદારોના આંકડા જાહેર કર્યા છે. પંચના જણાવ્યા મુજબ આગમી લોકસભા ચૂંટણી માટે ૯૬.૮૮ કરોડ મતદારો રજીસ્ટર્ડ છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદારોની યાદી જાહેર કરી દીધી છે. પંચે એક જાન્યુઆરી-૨૦૨૪ સુધીના આંકડા જાહેર કર્યા છે. દેશમાં કુલ ૯૬.૮૮ કરોડથી વધુ મતદારો રજીસ્ટર્ડ છે. વિશ્વભરમાંથી સૌથી વધુ ભારતમાં મતદારોનો વર્ગ છે. ૨૦૧૯માં આ આંકડો ૮૯.૬ કરોડ હતો. દેશમાં પુરુષ મતદારોની સંખ્યા ૪૯.૭ કરોડ છે, જ્યારે ૨૦૧૯માં ૪૬.૫ કરોડ હતા. જ્યારે મહિલા મતદારો ૪૭.૧ કરોડ છે, જે ગત ચૂંટણીમાં ૪૩.૧ કરોડ હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે, મતદારોની યાદીમાં ૨.૬૩ કરોડથી વધુ નવા મતદારો પ્રથમવાર લોકસભાની પર્વ ચૂંટણીમાં ભાગીદાર બનશે. આમાંથી ૧.૪૧ મહિલા જ્યારે ૧.૨૨ કરોડ પુરુષ મતદારો પ્રથમવાર મતદાન કરશે. આમ નવા પુરુષોના મુકાબલે નવી મહિલા મતદારોની સંખ્યા ૧૫ ટકા વધુ છે. ચૂંટણી પંચના ડેટા મુજબ દેશમાં ૧૮-૧૯ની ઉંમરના ૧.૮૫ કરોડ યુવા મતદારો છે, જે ગત ચૂંટણીમાં ૧.૫ કરોડ હતા. ૧૮-૧૯ અને ૨૦-૨૯ની ઉંમરના બે કરોડથી વધુ યુવા મતદારોને મતદાર યાદીમાં જોડવામાં આવ્યા છે. દેશભરમાં દિવ્યાંગ મતદારોની સંખ્યા ૮૮.૩૫ લાખ છે. જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં ૪૫.૬૪ લાખ પીડબલ્યુડીમતદારો હતા. જ્યારે અન્ય મતદારોની સંખ્યા ૪૮,૦૪૪ નોંધાર્થી છે, જે ગત વર્ષે ૩૯.૬૮૮ હતા. ચૂંટણી પંચે જણાવ્યું કે, ઘર-ઘરે પહોંચી વેરિકેશન કરાયા બાદ મૃત્યુ પામેલ, સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોના નામ યાદીમાંથી કઢાયા છે, જે આંકડો ૧,૬૫,૭૬,૬૫૪ નોંધાયો છે. આમાં ૬૭,૮૨,૬૪૨ મૃતક મતદારો, ૭૫,૧૧,૧૨૮ સ્થળાંતર અથવા ગેરહાજર મતદારો જ્યારે ૨૨,૦૫,૬૮૫ ડુપ્લિકેટ મતદારો સામેલ છે.

તંત્રી લેખ...

G7 ગુપે ઈરાનને આચો કડક સંદેશ, રશિયાને મિસાઈલ ન મોકલો

રશિયામાં ચૂંટણી વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની મુશ્કેલીઓ વધી ગઈ છે. જ્યાં ઈરાન યુકેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મિસાઈલ, ડ્રોન અને એરિયલ બોમ્બ મોકલવાને રશિયાને ઘણી મદદ કરી રહ્યું હતું, ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે તેને રોકવામાં આવી રહ્યું છે. હવે ૨૭ ગુપે ઈરાનને ચેતવણી આપી છે. G7 ગુપે ઈરાનને રશિયાને મિસાઈલ ન મોકલવાનો સંદેશ આપ્યો છે, જો તે આવું કરશે તો તેને સખત પરિણામ ભોગવવા પડશે. G7 દેશોએ શુક્રવારે ઈરાનને ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો ઈરાન રશિયાને નજીકની બેલેસ્ટિક મિસાઈલ મોકલશે તો તેને સખતો સામનો કરવો પડશે. રશિયા અને યુકેન વચ્ચે બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન રશિયાને મિસાઈલો મોકલી રહ્યું છે. જેના પર G7 દેશોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. G7 દેશોએ કહ્યું કે જો ઈરાન પોતાની કાર્યવાહી બંધ નહીં કરે તો યુરોપ જતી ઈરાની એર ફ્લાઈટ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. G7 દેશોએ તેના ૨૭ સહયોગી દેશો સાથે ઈરાન અને અમેરિકાને ચેતવણી આપી હતી કે જો ઈરાન હવે રશિયાને મિસાઈલ મોકલશે તો તેને પરિણામ ભોગવવા પડશે. G7ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો ઈરાન રશિયાને બેલેસ્ટિક મિસાઈલ અથવા સંબંધિત ટેકનોલોજી આપવાનું ચાલુ રાખશે તો અમે ઈરાનને જવાબ આપવા માટે તૈયાર છીએ. અમેરિકા ઈરાન પ્રત્યે આક્રમક વલણ અપનાવી રહ્યું છે. જો કે, ૨૭ એ રોઈટરના અહેવાલ પછી આ પગલું ભર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેહરાન (ઈરાનની રાજધાની) યુકેન પર હુમલો કરવા માટે રશિયાને મોટી સંખ્યામાં શક્તિશાળી બેલેસ્ટિક મિસાઈલો મોકલી છે. તમને જણાવી દઈએ કે, મુખ્ય પશ્ચિમી લોકશાહી દેશોના ૨૭ જૂથની અધ્યક્ષતા હાલમાં ઇટાલી પાસે છે અને તેમાં અમેરિકા, જાપાન, જર્મની, બ્રિટન, ફ્રાન્સ અને કેનેડા પણ સામેલ છે. વરિષ્ઠ અમેરિકન અધિકારીએ કહ્યું, G7 ઈરાનની યુરોપની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકશે. તમને જણાવી દઈએ કે, ઈરાન એર મુસાફરોને ઈરાનથી યુરોપના ઘણા શહેરોમાં લઈ જાય છે. G7 આ ફ્લાઈટ પર જ પ્રતિબંધ મૂકશે. જો કે, યુનાઈટેડ સ્ટેટ્સ પુષ્ટિ કરી શક્યું નથી કે મિસાઈલ પહેલેથી જ રશિયાને મોકલવામાં આવી હતી કે કેમ, અધિકારીએ જણાવ્યું હતું. રોઈટરના અહેવાલ મુજબ, તેહરાન દ્વારા મિસાઈલો પર મોસ્કો (રશિયાની રાજધાની) સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભારતને ડ્રગ્સ સપ્લાય કરનાર કિંગ્પિન હાજુ સલીમ વિશે સાંભળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ

આ વર્ષે ભારતમાંથી હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ જમ કરવામાં આવ્યા છે, પરંતુ તેના કિંગ્પિનની વાત સાંભળીને સુરક્ષા એજન્સી સતર્ક થઈ ગઈ છે. તેનું નામ હાજુ સલીમ હોવાનું કહેવાય છે અને તે અંડરવર્લ્ડ ડ્રોન દાઉદ ઈબ્રાહિમ અને એલટીટીઈ ઈર્ગર્સ ઓફ તમિલ એલમ (એલટીટીઈ) બંનેની નજીક હોવાનું કહેવાય છે. આ સાથે સલીમને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISA દ્વારા પણ મદદ કરવામાં આવે છે, જે તેની સુરક્ષામાં મદદ કરે છે એટલું જ નહીં પરંતુ તેનું સ્થાન બદલવામાં પણ મદદ કરે છે. હાલમાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓને હાજુ સલીમના ઈરાદાઓ વિશે આવી માહિતી મળી છે જે ચિંતાનો વિષય છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ડ્રગ્સના કન્સાઈનમેન્ટની ડિલિવરી કરનાર આ ગેંગસ્ટર ફરી એકવાર શ્રીલંકામાં ગેંગસ્ટર લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ નામના સંગઠનને પુનઃજીવિત કરવાની યોજના બનાવી રહ્યો છે. આ સાથે તેને ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે LTTEની મદદ પણ મળી રહી છે.

હાજુ સલીમ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર છે જે કરાચીમાં રહે છે અને ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે. તે પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન અને હિંદ મહાસાગર મારફતે વિશ્વના ઘણા દેશોમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. સુત્રોના જણાવ્યા અનુસાર તેના અન્ય ડ્રગ માફિયા અને આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ સાથે ઊંડા સંબંધો છે. એવું માનવામાં આવે છે કે આ બંને દાણચોરી માટે એકબીજાના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છે.

આ સાથે હાજુ સલીમને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા, ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ તેમજ અન્ય અનામી લોકોનું સમર્થન છે. એવું પણ કહેવાય છે કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પણ તેનું સમર્થન કરે છે. AK-47 અને એસોલ્ટ રાઈફલ્સથી સજ્જ ગાર્ડ્સ ૨૪ કલાક સુરક્ષા પર રહે છે. તે પાકિસ્તાનથી માલદીવના દરિયાઈ વિસ્તારોમાં તેના ડ્રગ સિન્કેટને નિયંત્રિત કરવા માટે સેટેલાઈટ ફોનોનો ઉપયોગ કરે છે. તે સામાન્ય રીતે હેરોઈનનો વેપાર કરે છે અને ડ્રગની દાણચોરીમાં થી જે પૈસા કમાય છે તેનો ઉપયોગ પાછળથી આતંકવાદને ટેકો આપવા માટે કરવામાં આવે છે.

તે ભારત, માલદીવ, શ્રીલંકા અને મધ્ય પૂર્વના કેટલાક દેશોમાં દાણચોરી પર નજર રાખવા માટે જવાબદાર છે. તેની કાર્ટેલની બહુવિસ્તારમાં ઘણી ગુપ્ત પ્રયોગશાળાઓ છે, જ્યાં ડ્રગના માલસામાન તૈયાર કરવામાં આવે છે. આ સાથે તેને હવાલા દ્વારા રોકડ પણ મળે છે. સલીમ અને તેના સહયોગીઓ ઘણા કોડ નામોનો ઉપયોગ કરે છે જેથી તેઓ કાયદા અમલીકરણ એજન્સીઓના રડારમાં ન આવે. તે દરેક પેકેટ પર કોડ લખે છે, ઉદાહરણ તરીકે પપપ, ૭૭૭ અને ૯૯૯, ઉડતો ઘોડો, યુનિકોર્ન અને ડ્રેગન. ભારતમાં લગભગ ૭૦% ડ્રગ્સની દાણચોરી દરિયાઈ માર્ગે થાય છે અને તેમાંથી મોટાભાગની દાણચોરી દરિયાઈ માર્ગે થાય છે. પાકિસ્તાન અને હિંદ મહાસાગરમાં કાર્યરત કરોડો ડોલરના નેટવર્કનો માસ્ટરમાઈન્ડ હોવા ઉપરાંત, તે ભારત અને ઉપખંડમાં શસ્ત્રોની દાણચોરી માટે પણ જવાબદાર માનવામાં આવે છે.

હાજુ સલીમનું દાઉદ સાથે જોડાણ અધિકારીઓનો દાવો છે કે સલીમ દાઉદ ઈબ્રાહિમ સાથે નજીકથી કામ કરી રહ્યો છે કારણ કે તે દેખીતી રીતે કરાચીમાં ઈબ્રાહિમના કિલકટન રોડ સ્થિત નિવાસસ્થાને ઘણી વખત જોવા મળ્યો હતો. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIAના જણાવ્યા અનુસાર શ્રીલંકાના ડ્રગ માફિયાના સભ્યો હાજુ સલીમ સાથે પણ કનેક્શન ધરાવે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને રિફોર્ટરેટ ઓફ રેવન્યુ એન્ડ ઈન્ટેલિજન્સ સાથે મળીને દાઉદની કંપની સાથે જોડાયેલા સમગ્ર ગુનાહિત નેટવર્કને તોડી પાડવા માટે સાલેમના ભારતીય કનેક્શનને ઓળખી કાઢ્યા છે. આ સંયુક્ત ઓપરેશન માટે આભાર, તેઓએ ૫૫, ૧૧૫ પાઉન્ડ અથવા ૨૫૦૦ કિલોગ્રામ ઉચ્ચ શુદ્ધતા મેથાફેટામાઈન જમ કર્યું.



સુપ્રીમની સૂચના પર ચૂંટણી પંચે આંકડાઓ જાહેર કર્યા, એટલે કે એસબીઆઈ તરફથી મળેલ ઇલેક્શન બોન્ડ માટેના ડેટા વેબસાઇટ પર અપલોડ કરી દીધાં

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી નજીક આવતાં મોદી સરકાર પૂરાં જુસ્સા અને સ્ટ્રેટેજી સાથે મેદાનમાં!

એટલાં એક વીકના છાપાઓ તેમજ સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ટીવી મીડિયા દ્વારા સતત લોકસભાની ચૂંટણીના સંદર્ભે જુદી જુદી રીતે મેસેજ આવતાં રહે છે. જોકે એને મેસેજ કેમ કહેવા એક પક્ષ બીજા પક્ષની ઈજ્જત ઉછાળવા જાણે મેદાનમાં આવ્યા હોય એવું જ છે! કોઈ કહેશે આ પક્ષ આવશે તો હિન્દુ સલામત નથી, તો બીજો પક્ષ કહેશે લઘુમતી ને દેશમાંથી કાઢવા ટાર્ગેટ છે, જોકે લોકશાહી હોવા છતાં નિગરિકની અણદેખ્યું કરવાથી આમ પણ આપણે કંઈ કરી શકવાના નથી! આવતીકાલે લગભગ ચૂંટણીની તારીખ અને તેનો પ્રોગ્રામ નક્કી થઈ જશે, જાણને કુમાર અને સુખબીર સિંહને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક દેશ એક ચૂંટણીનો અહેવાલ વર્તમાન રાષ્ટ્રપતિને સુપ્રત કર્યો, અને વિપક્ષ એ આક્ષેપ કર્યો કે ભાજપ આ રીતે સંપૂર્ણપણે બંધારણ બદલવા માંગે છે. સુપ્રીમની સૂચના પર ચૂંટણી પંચે આંકડાઓ જાહેર કર્યા, એટલે કે એસબીઆઈ તરફથી મળેલ ઇલેક્શન બોન્ડ માટેના ડેટા વેબસાઇટ પર અપલોડ કરી દીધાં છે. ગુડપ્રધાન અમિત શાહ એ કહ્યું કે CAA એટલે કે નાગરિકતા સંશોધનનો કાયદો કોઈ કાળે પાછો લેવામાં નહીં આવે! શું વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી? કારણ કે એપ્રિલ/મે ૨૦૨૪ અંતર્ગત મોટેભાગે લોકસભાની ચૂંટણીનું કાર્ય સંપન્ન થશે. હજી કોઈ નિશ્ચિત તારીખ આવી નથી, પરંતુ એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં લગભગ ચૂંટણી યોજાશે એવી ખબર ફેલાઈ રહી છે. એક વીક પહેલાં સરકારે ચૂંટણી લોલીપોપ તરીકે ૪ ટકા ડીએ નો વધારો કર્યો, ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો, પેટ્રોલ ડીઝલમાં બે



રૂપિયાનું ઘટાડો કર્યો, રાંધણ ગેસમાં પણ સો રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો, બહુ દેખીતી રીતે જ સરકારે આમ જનતાને આવા પ્રલોભનો આપ્યાં, કારણ કે મધ્યમ વર્ગના વોટ માટે અમુક પ્રકારના નિર્ણયો જરૂરી હતાં, આધુનિક વિકાસ એટલે કે શહેરો અને મહાનગરના મોલ કે મલ્ટિપ્લેક્સ અથવા બ્રાન્ડના શો રુમ! એ શ્રમજીવી કે મધ્યમવર્ગીયનું પેટ ભરી શકે નહીં. આ ઉપરાંત બીજેપી કેન્ડિડેટના લીસ્ટ પણ જાહેર કરાયાં, અને લગભગ બધા જ જિલ્લાઓ માંથી ભાજપના ઉમેદવાર તરીકે કોણ લોકસભાની ચૂંટણી લડશે, એના નામ પણ જાહેર થઈ ગયા છે. ભાવનગરમાં ભારતી બેન શિયાળની જગ્યાએ નિમુબેન બાંભણિયાને ટિકિટ આપી, આમ મહિલા સીટ સુરક્ષિત રાખી, અને આમ ઘણી જગ્યાએ સીટની ફેરબદલી થઈ છે. ઘણા અન્ય દિગ્ગજવિપક્ષી નેતાઓ એ છેલ્લે છેલ્લે પાટલી બદલી, આમ લોકસભાની ચૂંટણી માટે દરેક પક્ષ પોતપોતાના પક્ષનું કેમ્પેઈન કરી રહ્યા છે. ભાજપ સરકારે પોતાની જીત માટે આમ આ વખતે બહુ મહેનત કરવી નહીં પરંતુ કારણકે આપણે વિકાસ જોઈ શકીએ છીએ અને જે માત્ર ઓન પેપર નથી! ૨૦૧૪ સબકા સાથ સબકા વિકાસ! અને ૨૦૧૯ ફિર એક બાર મોદી સરકાર! ૨૦૨૪ તીસરી બાર મોદી

સરકાર અબ કી બાર ચારસો પાર! સપને નહિ હકીકત બૂનતે હે, તબી તો સખ મોદી કો ચૂનતે હે! તેમજ મોદી સરકારની ગેરંટી! આ ઉપરાંત ખુદ વડાપ્રધાન એ યુવાવર્ગમાં ચૂંટણી માટે અવરનેસ આવે એટલે બેલાડીઓ તથા અભિનેતા અભિનેત્રી ગાયક ગાયિકા જેવા યુવાનો ને મત આપવા માટે અપીલ કરતાં વિડિયો અને એડવર્ટઈઝ કરવા અપીલ કરી છે, અને ઘણા એ એની શરૂઆત પણ કરી દીધી છે. જેમકે છેલ્લી બે ટર્મથી ભાજપ સરકાર ચૂંટણી ના પરિણામોમાં અગ્રેસર રહેતી હોવાથી બહુ સ્વાભાવિક રીતે જ લોકોને એના સ્વોગન અને સુત્રમાં વધુ રસ હોય. ૨૦૧૪ ની ચૂંટણીમાં ભાજપ સરકારે સબકા સાથ સબકા વિકાસ એ મૂળ એજન્ડા સાથે ચૂંટણી નેટવર્કને પ્રબળ બનાવ્યું હતું, અને પ્રચારકો ગામેગામ આ સુત્રનો નારો લગાવી જીત હાંસલ કરી. ભારત દેશ પોતે એક તો પોતાની વસ્તીને કારણે બહુ મોટી લોકશાહી ધરાવતો દેશ છે, અને જે કોઈ સરકાર આવે તેની સામે આમ તો ચેલેન્જ પર ચેલેન્જ છે! કારણ કે એક સાથે આટલા નાગરિકોનું હેત વિચારવું એ કંઈ સહેલી વાત નથી. પણ જોકે એતો નાગરિકના પ્રોબ્લેમને પોતાના સમજે તો! બાકી તો બધું... આમ જુઓ તો જનતાએ પણ હવે લગભગ દરેક સરકારને અજમાવી જોઈ છે. એટલે એને

પણ અંદાજ તો આવી જ ગયો છે કે, કોણ સુપ્રીમો છે. પરંતુ તેની સાથે સાથે બીજી એક વાત એ પણ જરૂરી છે કે, લોકશાહી માં નાગરિકોએ ચૂંટણી પ્રત્યે પૂર્ણપણે જાગૃત રહેવું પડે, અને જે કોઈ સરકારનું આધિપત્ય રચાય, ત્યારે એ સરકારે પણ અંતેતો લોક સેવક છે, એ યાદ રાખવું ઘટે. કારણ કે નો ડાઉટ છેલ્લા દસ વર્ષમાં ભારતે અપ્રીતમ સિદ્ધિ હંસલ કરી છે, વિકાસની મામલે પણ તે હવે ઘણો આગળ છે, ટેકનોલોજીની રીતે પણ ભારત ઘણો સક્ષમ થતો જાય છે, આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ હવે તેનું મૂલ્યાંકન થવા લાગ્યું છે, અને એને કારણે વિદેશ વેપાર નીતિની ક્ષિતિજે સૂર્ય ઝગમગાટ કરે છે. શૈક્ષણિક ક્ષેત્રે પણ ઘણાં બદલાવ આવ્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે, દરેક સરકારી ઓફિસો ભ્રષ્ટાચાર મુક્ત કરવાં માટે બહુ કડક પગલાં ભરવામાં આવ્યા છે, અને દરેક સરકારી નોકરિયાત પાસેથી પૂરેપૂરું કામ લેવામાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. જવાનો ના હિત માટે ઘણા નિર્ણયો લીધા છે, હથિયારો તેમજ જહાજોની ખરીદી કરી છે, અને સીમા સુરક્ષા વિશે પણ એણે ઘણું કામ કર્યું છે. ૩૭૦ ની કલમનો નિવેડો લાવવાનું અશક્ય પણ છતાં બહુ જ અનિવાર્ય કાર્ય પણ કર્યું છે, અને કાશ્મીર તેમજ લડાક

આપણે ધર્મ ભાવનાથી એટલા બધા ઘેરા રંગે રંગાયેલા છીએ કે તેમાંથી વૈજ્ઞાનિક અર્થ તારવી કાઢવાનું આપણને ફાવતું નથી

જે દિવસે માણસ પોતાના સ્વભાવ પર વિજય મેળવશે તે દિવસે તેની ખામીઓ દૂર થઈ જશે

આપણું શરીર અને આ જગત પણ પંચ મહાભૂતનું બનેલું છે. એ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પૃથ્વીમાં ઘન તત્ત્વો આવી જાય છે. જલમાં પ્રવાહી આવે છે, વાયુમાં બધા વાયુઓ સમાઈ જાય છે. તેજમાં બધી શક્તિનો સમાવેશ થાય છે અને આકાશ એટલે ખાલી જગ્યા છે. ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં આધ્યાત્મિક મંત્રો અને વૈજ્ઞાનિક સૂત્રો બંને સમાવી દીધાં છે. આપણે માત્ર આધ્યાત્મિક દૈષ્ટિ કેળવી અને વિજ્ઞાનને ભૂલી ગયા. આપણે ધર્મ ભાવનાથી એટલા બધા ઘેરા રંગે રંગાયેલા છીએ કે તેમાંથી વૈજ્ઞાનિક અર્થ તારવી કાઢવાનું આપણને ફાવતું નથી. ગુલામીના કાળ દરમ્યાન વિજ્ઞાનના સંસ્કાર આપણામાંથી અલોપ થઈ ગયા છે. સ્વતંત્ર થયા પછી ભારત ની પ્રજા ફરીથી વિજ્ઞાનમાં રસ લેવા લાગી છે. આથી આપણા શાસ્ત્રોમાંથી તત્ત્વજ્ઞાન ઉપરાંત વિજ્ઞાનનો અર્થ પણ શોધવો જોઈએ આમ કરવાથી વિજ્ઞાનના ક્ષેત્રે કોઈ નવી શોધ થશે એવું કંઈ નથી, પરંતુ તે કાળમાં પણ આપણા પૂર્વજોને વિજ્ઞાન વિશે કેવું જ્ઞાન હતું તે જાણીને આપણને



ગૌરવ થશે અને વિજ્ઞાનના ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે. આપણે કેવા પૂર્વજોના વંશજ છીએ તેનું ભાન આપણને નવી પ્રેરણા આપશે અને ગુલામીના કાળ દરમ્યાન આપણમાં જે લઘુતાની ગ્રંથિ બંધાઈ ગઈ છે તે નીકળી જશે. અમેરિકા, રશિયા, જાપાન, ઈંગ્લેન્ડ વગેરે દેશો જો વિજ્ઞાનના ક્ષેત્રે આગળ વધી શકે તો આપણે શા માટે ન વધી શકીએ? વાસ્તવમાં આપણા વિજ્ઞાનીઓએ વિદેશોમાં નામના મેળવી છે, એટલું જ નહિ પણ આપણા કેટલાક વિજ્ઞાનીઓ ઈંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં વસી ગયા છે અને તે દેશની વૈજ્ઞાનિક પ્રગતિમાં ફાળો આપ્યો છે. આપણા દેશમાં તેમને પૂરતી સગવડ, પ્રોત્સાહન, અને અનુકૂળ વાતાવરણ મળતાં નથી

મેળવવાની ક્ષમતા હોય છે, તો પછી તમે જાતે જ તમારી ખુશીના દરવાજા બંધ કરી દીધા છે. સુખ મેળવવાની ઈચ્છામાં માણસ ઘર અને ઢુકાનો બદલી નાખે છે. ક્યારેક દેશ બદલાય છે તો ક્યારેક વેશ પણ બદલાય છે. પરંતુ તે પોતાની વિચારસરણી અને સ્વભાવ બદલવા તૈયાર નથી. તમારી ભૂમિકા બદલો, જમીન નહીં. જે દિવસે માણસ પોતાના સ્વભાવ પર વિજય મેળવશે તે દિવસે તેની ખામીઓ દૂર થઈ જશે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષમાં અનોખો થન ગનાટ શરૂ થઈ ગયો છે. શાસક પક્ષના નેતાઓ અને કાર્યકરો માટે તો કાયમી ચૂંટણી જેવો જ માહોલ છવાયેલો છે. વાયક ચાહક મિત્રો, આપણે ભગવદ્ ગીતામાં હૃદય મનમાં એક અનોખી તાજગી ભરવા પ્રયત્ન કરીએ છીએ. પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો થયો પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી નહી થાય એ નક્કી. શિક્ષિત યુવાધન બેરોજગારીના ખપ્પરમાં હોમાઈને વ્યસનો ડિપ્રેશન ભોગ બની રહયો હોવા છતાં દેશના કહેવાતા લોકસેવકોની ઊંઘ ઉડતી નથી. બસ ભારત માતા કી જય અને વંદે માતરમ્ જ...અસ્તુ.

વિશેષ
ચમપાલસિંહ ટી. વાહેલા
(દરબાર ગઠ, ઘરા)

ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં આધ્યાત્મિક મંત્રો અને વૈજ્ઞાનિક સૂત્રો બંને સમાવી દીધાં છે. આપણે માત્ર આધ્યાત્મિક દૈષ્ટિ કેળવી અને વિજ્ઞાનને ભૂલી ગયા



કબજિયાતમાં રાહત આપે છે નાગરવેલના પાન

નાગરવેલના પાનનું પાણી પીવાથી કબજિયાતથી લઇને સાંધાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકાય છે

નાગરવેલના પાન ભારતની સંસ્કૃતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં સદીઓથી તેનો ઉપયોગ થતો આવ્યો છે. નાગરવેલના પાનનો ઉપયોગ ખાસ કરીને હિંદુ ધર્મમાં પૂજા દરમિયાન કરવામાં આવે છે. આ સિવાય સદીઓથી આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર નાગરવેલના પાનનું સીધું સેવન કરવામાં આવે છે, જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. પરંતુ જો તમે નાગરવેલના પાનનું સેવન કરી શકતા નથી, તો તેમાંથી પાણી બનાવીને પીવો. નાગરવેલના પાનનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ચાલો જાણીએ કે નાગરવેલના પાનનું પાણી પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે? નાગરવેલના પાન એન્ટિઓક્સિડન્ટ્સનું પાવરહાઉસ હોવાનું કહેવાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતી સમસ્યાઓથી બચાવે છે. જો તમે નિયમિત રીતે નાગરવેલના પાનનું પાણી પીતા હોવ તો કબજિયાતની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. શ્વાસની તકલીફ દૂર કરવા માટે નાગરવેલના પાનનું પાણી પીવો. નાગરવેલના પાનનું પાણી પીવાથી ઉધરસ અને શરદી મટે છે. તે ફેફસામાં એકઠા થયેલા કફને બહાર કાઢી શકે છે. અસ્થમાની સારવાર પણ કરી શકે છે. નાગરવેલના પાનનું પાણી નિયમિત પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. ખરેખર, નાગરવેલના પાનમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે, જે મોઢામાં પેદા થતાં બેક્ટેરિયાને નષ્ટ કરી શકે છે. તેની મદદથી કેવિટી, દાંતનો સડો અને પ્લાક સંબંધિત સમસ્યાઓ ઘટાડી શકાય છે. ભારે ખોરાક ખાધા પછી લોકો વારંવાર પેટ ફૂલવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં નાગરવેલના પાનનું પાણી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નાગરવેલના પાનમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે, જે તમારા પેટને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓથી રાહત આપવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જો તમને અપચો અને પેટ ફૂલવાની સમસ્યા હોય તો નાગરવેલના પાનનું પાણી પીવો. નાગરવેલના પાનનું પાણી સાંધાના દુખાવામાં રાહત અપાવવામાં મદદરૂપ થઈ શકે છે, કારણ કે તેમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. નાગરવેલના પાનનો ઉપયોગ કરીને ઓસ્ટિયોપોરોસિસ અને સંધિવાથી થતી સમસ્યા અને પીડામાંથી રાહત મેળવી શકાય છે. નાગરવેલના પાનનું પાણી બનાવવા માટે ૨ થી ૩ નાગરવેલના પાન લો. તેને ૧ ગ્લાસ પાણીમાં નાખીને આખી રાત રહેવા દો.

ટ્રેનના પૈડાં એવી રીતે બનાવવામાં આવે છે કે તે પાટાઓને એકદમ ચુસ્ત રાખે છે

આ તીક્ષ્ણ લોખંડ દ્વારા, ટ્રેનો એક લાઇનથી બીજી લાઇન પર આવે છે, એટલા માટે જ સ્ટીયરિંગ વગર પણ ટ્રેન ટર્ન થાય છે



કોઈ ડોય, જીપ ડોય, બસ ડોય કે ટ્રેક, તમામ વાહનો ફોલ્ડ કરીને ચલાવવામાં આવે છે. જો તમને લાગતું હોય કે ટ્રેક પર દોડતી ટ્રેનો પણ કન્ટ્રોલ્ડ સ્ટીયરિંગ દ્વારા જ નિયંત્રિત થાય છે, તો તમે ખોટો અંદાજ લગાવી રહ્યા છો. વાસ્તવિકતા એ છે કે ટ્રેનમાં સ્ટીયરિંગ નથી. વળી, ટ્રેનના એન્જિનમાં બેસેલા લોકો પાયલટની ટ્રેનને ટર્ન કરવામાં અને પાટા બદલવામાં કોઈ જ ભૂમિકા નથી. હવે તમારા મનમાં સવાલ જરૂરથી ઉઠશે કે જ્યારે ટ્રેનમાં સ્ટીયરિંગ નથી હોતું તો ટ્રેન કેવી રીતે ટર્ન લે છે? વળાંક પર દિશા બદલવી વખતે અને ખસેડતી વખતે તે બીજા ટ્રેક પર કેવી રીતે આગળ વધે છે? પાટા ટ્રેનને ફેરવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવું નથી કે લોકો પાયલોટ ટ્રેનને ગમે ત્યારે અને ગમે ત્યાં ફેરવે છે. ટ્રેનને ચલાવવા માટે ટેકનિકલ સિસ્ટમ અપનાવવામાં આવી છે. ટ્રેનના પૈડાં એવી રીતે બનાવવામાં આવે છે કે તે પાટાઓને એકદમ ચુસ્ત રાખે છે. તેથી જ્યારે ટ્રેન આગળ વધે છે ત્યારે તેના પૈડાં પાટાને છોડતા નથી. સાથે જ જ્યાં પાટા ફેરવે છે ત્યાં જ ટ્રેકની અંદર ધારદાર લોખંડ હોય છે. તેનાથી પૈડાંની દિશા બદલાઈ જાય છે. આ તીક્ષ્ણ લોખંડ દ્વારા, ટ્રેનો એક લાઈનથી બીજી લાઈન પર આવે છે. એટલા માટે જ સ્ટીયરિંગ વગર પણ ટ્રેન ટર્ન થાય છે. પોઈન્ટ્સમેન ટ્રેન ફેરવે છે: રેલવેમાં એક એવો કર્મચારી છે જેને ટ્રેન બદલવા એટલે કે ટ્રેક બદલવા માટે પોઈન્ટમેન કહેવામાં આવે છે. ટ્રેક બદલવાનો નિર્ણય લોકો પાઈલટ દ્વારા નહીં પરંતુ સ્ટેશન માસ્ટર દ્વારા લેવામાં આવે છે. રેલવે હેડક્વાર્ટર નક્કી કરે છે કે ટ્રેનને કયા સ્ટેશનના કયા પ્લેટફોર્મ પર રોકવું પડશે અને કયા સ્ટેશન પર તેને રોકવામાં નહીં આવે. ટ્રેન ચલાવવા માટે લોકો પાઈલટ જવાબદાર છે. તે કાર ન ફેરવી શકે તેમ છતાં તે ગાર્ડ સાથે સંકલન સાધીને ટ્રેન ચલાવે છે. લોકો પાઈલટ સિગ્નલ જુએ છે અને ટ્રેનને ચલાવવાનું અથવા રોકવાનું નક્કી કરે છે. ઝડપ વધારવા કે ઘટાડવા માટે ગિયર બદલે છે. લોકો પાયલોટ ટ્રેકની બાજુમાં આવેલા સાઈન બોર્ડ પરના સંકેતો અનુસાર સ્પીડ બદલવી પડે છે. ઈમરજન્સીની સ્થિતિમાં જ્યારે વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક થઈ શકતો નથી.

ભારતનો ૧ રૂપિયો ઈરાનના ૫૦૦ રૂપિયા બરાબર



શું તમે જાણો છો કે એક એવો દેશ છે જ્યાં ભારતીય રૂપિયાની કિંમત હાલમાં એટલી વધી ગઈ છે કે તમે તેના પર વિશ્વાસ કરી શકશો નહીં. આ એક ખૂબ જ સુંદર અને પ્રાચીન દેશ છે, જેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ પણ છે. આ દેશ સાથે ભારતના ઘણા જૂના સંબંધો છે. આ દેશ વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાં સામેલ છે પરંતુ અમેરિકન પ્રતિબંધોને કારણે તેની હાલત ખરાબ થઈ રહી છે. આ દેશમાં ૦૧ ભારતીય રૂપિયો ઓછામાં ઓછા ૫૦૦ રૂપિયા બરાબર છે. હવે અમે તમને જણાવીએ કે આ કયો દેશ છે. આ દેશ ઈરાન છે, જ્યાંનું સત્તાવાર ચલણ રિયાલ-એ-ઈરાન છે, જેને અંગ્રેજીમાં ઈરાની રિયાલ કહે છે. એક સમય હતો જ્યારે રિયાલનું મૂલ્ય ઘણું સારું હતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેનું ધોવાણ થયું છે. તેનું કારણ એ છે કે અમેરિકાએ આ દેશ પર ઘણા વર્ષોથી અનેક પ્રકારના આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જેના કારણે તે પોતાનું તેલ દુનિયાને વેચવા પણ સક્ષમ નથી. આ કારણે તેની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે પરંતુ ભારત સાથે તેના સંબંધો છે. હાલમાં એક ભારતીય રૂપિયો ૫૦૭.૨૨ ઈરાની રિયાલ છે. મતલબ કે જો કોઈ ભારતીય

આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે પરંતુ ભારત સાથે તેના સંબંધો છે, હાલમાં એક ભારતીય રૂપિયો ૫૦૭.૨૨ ઈરાની રિયાલ છે



૧૦,૦૦૦ રૂપિયા લઈને ઈરાન જાય છે, તો તે ત્યાં રોકાઈ શકે છે અને લક્ઝરી રીતે ફરી શકે છે. ત્યાંની સારી ફાઈવ સ્ટાર હોટલનું દૈનિક ભાડું મહત્તમ રૂ. ૭૦૦૦ સુધીનું છે પરંતુ મધ્યમ વર્ગની હોટેલો રૂ. ૨૦૦૦થી રૂ. ૪૦૦૦ વચ્ચે સરળતાથી ઉપલબ્ધ છે. જો કે ઈરાનમાં ડોલર રાખવા એ મોટો ગુનો છે. પણ પૈસા રાખી શકાય. ઈરાને છેલ્લા કેટલાક સમયથી ડોલર સ્વીકારવાનું બંધ કરી દીધું છે. હવે તે ભારત સહિત ઘણા દેશો સાથે સ્થાનિક ચલણમાં જ વેપાર કરે છે. પરંતુ તેના કારણે ત્યાં ડોલરની દાણચોરીનો ગેરકાયદે ધંધો પણ ફૂલીફાલી રહ્યો છે. રિયાલ ઈરાનમાં ખૂબ જ જૂનું ચલણ છે. તે સૌપ્રથમ ૧૭૯૮માં રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ ૧૮૨૫માં રિયાલ જરૂરી કરવાનું બંધ થયું. તે ફરીથી બહાર પડવામાં આવ્યું હતું. ૨૦૧૨થી રિયાલ ઝડપથી ઘટવા લાગ્યું. જૂન ૨૦૨૦ સુધીમાં ઈરાની રિયાલ ૨૦૧૮ની શરૂઆતથી

લગભગ પાંચ ગણો ઘટી ગયો હતો. ત્યાં ફુગાવો રેકોર્ડ સ્તરે વધવા લાગ્યો. હવે ત્યાં વસ્તુઓ ઘણી મોંઘી થઈ ગઈ છે. ૨૦૨૨માં ઈરાનનો ફુગાવો ૬૨.૪% હતો, જે વિશ્વમાં દસમો સૌથી વધુ છે. જેના કારણે બેરોજગારી પણ વધી છે. જોકે, ઈરાનમાં મોટાભાગના લોકો રોજગારને બદલે પોતાનું કામ કરવાનું પસંદ કરે છે. ત્યાંની વસ્તીના માત્ર ૨૭.૫ ટકા લોકો ઔપચારિક રોજગારમાં છે પરંતુ ગરીબી વધીને ૫૦ ટકાથી વધુ થઈ ગઈ છે. ભ્રષ્ટાચાર પણ ઘણો છે. ઈરાન એક સુંદર દેશ છે. અદ્ભુત સ્થાપત્ય પ્રકૃતિના અદભૂત દેશો સાથે ત્યાં જોઈ શકાય છે. આ એક આકર્ષક દેશ છે અને અહીં ઘણી સુંદર જગ્યાઓ છે. અહીંના લોકો મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંની સભ્યતા ૭૦૦૦ વર્ષથી વધુ જૂની છે. ઈરાનમાં બરફથી ઢંકાયેલ પર્વતો, લીલાછમ, ઊંડા જંગલો, મનોહર ટેકરાઓ અને ખારા સરોવરો સાથે સૂકા રણ છે. ઈરાનના ઉત્તરીય વિસ્તારોમાં લીલાં જંગલો જોવા મળે છે. તે ઘણા સુંદર શહેરોનું ઘર છે. સિએરા લિયોની અર્થવ્યવસ્થા પણ છેલ્લા કેટલાક દિવસોથી ઘણી અડચણોનો સામનો કરી રહી છે. હાલમાં એક ભારતીય રૂપિયો ૨૩૮.૩૨ રૂપિયા છે. એ જ રીતે ઈન્ડોનેશિયામાં ૦૧ ભારતીય રૂપિયાની કિંમત ૧૮૦ રૂપિયા બરાબર છે. વિયેતનામમાં આ કિંમત ૩૦૦ રૂપિયાની આસપાસ છે. આ બધા સુંદર દેશો છે, જ્યાં ઓછા પૈસામાં સરળતાથી મુલાકાત લઈ શકાય છે. તેના સુંદર કુદરતી સ્થાનો ઉપરાંત વિયેતનામ તેના સ્ટ્રીટ ફૂડ માટે જાણીતું છે.

૪૦ વર્ષની ઉંમરે મોહભંગ થયો, લાખોની નોકરી છોડી અમેરિકામાં રહેતો એરોન ફ્લેચર કોર્પોરેટ જોબ કરતો હતો, આજના યુવાનોની જેમ તેની પણ જીવનશૈલી હતી



સારી નોકરી, સરસ ઘર અને પુષ્કળ પૈસા સાથે ૪૦ વર્ષની ઉંમરે સારી નોકરી છોડી દીધી. લાખો રૂપિયાનો માસિક પગાર હોવા છતાં તેને લ્હી પની નોકરી ગમતી ન હતી. તેનો એવો મોહભંગ થયો કે તેણે પોતાનું આલીશાન મકાન પણ વેચી દીધું અને બેઘર બની ગયો. તે માત્ર થોડા કપડા લઈને નીકળી પડ્યો અને જંગલમાં રહેવા લાગ્યો. આખરે તેણે આનું કેમ કર્યું, જ્યારે તમે તેના વિશે જાણશો તો તમે આશ્ચર્યચકિત થઈ જશો. અહેવાલ મુજબ, અમેરિકામાં રહેતો એરોન ફ્લેચર કોર્પોરેટ જોબ કરતો હતો. આજના યુવાનોની જેમ તેની પણ જીવનશૈલી હતી. તેને બ્રાન્ડેડ કપડાં પહેરવાનો અને સારી કાર ચલાવવાનો પણ શોખ હતો. પરંતુ એક દિવસ તેને લાગ્યું કે દુનિયા જે રીતે પ્રગતિ કરી રહી છે તે એક દિવસ નાશ પામશે.

શા માટે આટલી બધી દોડધામ? અહીંથી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. ફ્લેચરે ટ્રેડિશનલ જીવન જીવવાનું નક્કી કર્યું અને બેઘર બની ગયો. તે લાકડાની નાની બગીચામાં કેટલાક કપડાં અને સામાન લઈને નીકળ્યો. હવે એક શહેરથી બીજા શહેરમાં જાય છે. લોકોને મળે છે. ખોરાક માટેનો પાક પણ ખેતરોમાં જ જાતે જ ઉગાડે છે. તે માને છે કે આ જીવન ખૂબ જ અદ્ભુત છે. એરોન કહે છે કે મારે જીવન જીવવા માટે બહુ પૈસાની જરૂર નથી. કંઈપણ ખર્ચ કરવાની જરૂર નથી. હું મારી નાની બગીચામાં મુસાફરી કરું છું અને ઘણા વિસ્તારોની શોધખોળ કરું છું. ઘણા શ્રીમંત લોકો વૈભવી હવેલીઓ તરફ દોડી રહ્યા છે, ત્યારે ફ્લેચરને આ જીવન ખૂબ ગમે છે. તે કહે છે કે તમારી પાસે જેટલા પૈસા હશે તેટલી તમારી આકાંક્ષાઓ વધુ હશે. તમે અસંતુષ્ટ દેખાશો.

૧૭ વર્ષના એક છોકરાએ ટ્રેનને જ ઘર બનાવી દીધુ રિપોર્ટ અનુસાર, જર્મનીમાં રહેતો સ્ટોલી જ્યારે ફક્ત ૧૬ વર્ષનો હતો, ત્યારે તેને આ આઈડિયા આવ્યો હતો

ટ્રેનમાં મુસાફરી કરવી સરળ નથી, દુર્ગંધ મારતા ડબ્બા, સાફ-સફાઈની તકલીફ. દરેક લોકો ઈચ્છે છે કે જલ્દી ઘર આવી જાય અને તે ઉતરી જાય. પરંતુ, ૧૭ વર્ષના એક છોકરાને ટ્રેનને જ ઘર બનાવી લીધું છે. તે ટ્રેનમાં જ રહે છે, ખાવા-પીવાનું અને સુવાનું બધું ટ્રેનમાં જ કરે છે. આ સિવાય તેણે ટ્રેનને પોતાની ઓફિસ પણ બનાવી લીધી છે. તે ત્યાંથી જ કામ કરે છે અને લાખો રૂપિયાની કમાણી પણ કરે છે. પરંતુ, તેની કોઈ મજબૂરી નથી, તે બુશી-બુશી આવું કરે છે. બીજાને પણ જણાવી રહ્યો છે કે, ફ્લેચરનું મોંઘુ ભાડું છોડીને તમે પણ ટ્રેનમાં આવી જાવ. રિપોર્ટ અનુસાર, જર્મનીમાં રહેતો સ્ટોલી જ્યારે ફક્ત ૧૬ વર્ષનો હતો, ત્યારે તેને આ આઈડિયા આવ્યો હતો. તેને ટ્રેનમાં ચાલવાનો શોખ હતો. તેણે મમ્મી-પપ્પાને કહ્યું કે, તે ટ્રેનમાં જ રહેવા ઈચ્છે છે. પહેલા તો મમ્મી-પપ્પાએ ના પાડી દીધી હત. પરંતુ, બાદમાં તેની વાત સાંભળીને તે પણ રાજ થઈ ગયા. તેનો બધો જ સામાન વેચી દીધો. તેનો ફ્લેટ છોડી દીધો અને ટ્રેનમાં તેણે રહેવાની વ્યવસ્થા કરી દીધી. તમે વિચારી રહ્યા હશો કે, કેવી રીતે કોઈ ટ્રેનમાં રહી શકે? જાણો શું છે હકીકત. લેસે સ્ટોલી કાયદાકીય રીતે ટ્રેનમાં રહે છે.



તે ફર્સ્ટ ક્લાસ કોચમાં મુસાફરી કરે છે. રાત્રે ટ્રેનમાં જ સુવે છે. ડીબી લાઈનમાં નાસ્તો કરે છે. વળી, તે સ્વિમિંગ પૂલમાં સ્નાન કરે છે. દરરોજ તે લગભગ ૧૦૦૦ કિલોમીટરનું અંતર કાપે છે. સારી-સારી જગ્યાએ જાય છે. જ્યાં મને કરે છે, ત્યાં રોકાય શકે છે. ફરવા લાયક જગ્યાને એક્સક્લુડ કરે છે. તમે વિચારી રહ્યા હશો કે તેના માટે તો ઘણું ભાડું ચુકાવવું પડશે? જી હાં, જો તમે દરરોજ ટિકિટ લેશો તો ભાડું ઘણું મોંઘુ પડશે. પરંતુ, લેસેની પાસે જર્મન રેલવેનું એન્યુઅલ રેલકાર્ડ છે. ફક્ત ૮,૫૦૦ પાઉન્ડ પાણી ૮.૫ લાખ રૂપિયામાં મળે છે, જેનાથી તમે આખું વર્ષ ક્યાંય પણ ફર્સ્ટ ક્લાસમાં સફર કરી શકો છો. કોઈપણ ટ્રેનમાં જઈ શકો છો. લેસે દરરોજ પોતાના લાઈફ ઓન ધ ટ્રેનના વીડિયો બનાવે છે અને તેને શેર કરે છે.

લોકોને વધુ પડતો આલ્કોહોલ પીધા પછી હેંગઓવર થાય છે

લોકોને વધુ પડતો આલ્કોહોલ પીધા પછી હેંગઓવર થાય છે. સામાન્ય ભાષામાં તેને દારૂનો નશો કહેવામાં આવે છે. ઘણા લોકો ઝ-પ પેગ પછી પણ સામાન્ય લાગે છે, જ્યારે કેટલાક લોકોને માત્ર એક પેગથી નશો ચઢી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી લોકો હેંગઓવરની વધુને વધુ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ આશ્ચર્યજનક છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે લોંગ કોવિડના કારણે લોકો ખરાબ હેંગઓવરનો પણ સામનો કરી રહ્યા છે. કોવિડના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે અને તેના કારણે દારૂ પીવા પર વધુ નશો થઈ જાય છે. નવા સંશોધનમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. અહેવાલ મુજબ, લાંબા સમયથી કોવિડ ચેપથી પીડિત લોકો ગંભીર હેંગઓવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ અંગેનો ખુલાસો ક્યુરિયસ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે. સંશોધન દર્શાવે છે કે લાંબા સમય સુધી રહેનાર કોવિડ ગંભીર હેંગઓવરનું કારણ બની શકે છે. આ સંશોધન યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટર કોવિડ સિન્ડ્રોમ ક્લિનિકમાં લાંબા



અહેવાલ મુજબ, લાંબા સમયથી કોવિડ ચેપથી પીડિત લોકો ગંભીર હેંગઓવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે

સમયથી કોવિડથી પીડિત કેટલાક દર્દીઓની ભરતી કરીને કરવામાં આવ્યું હતું. આમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ૧૧ મહિનાથી કોવિડ સામે લડતી એક મહિલા ચેપ પહેલા કોઈપણ સમસ્યા વિના વાઈન પીતી હતી,

પરંતુ હવે માત્ર એક જ ડ્રિંક લીધા બાદ તેની હાલત ખરાબ થઈ જાય છે. આટલું જ નહીં તે પોતાના શરીરને મૂવ પણ કરી શકતી નથી. ૩ મહિના સુધી કોવિડ સંક્રમણ સામે ઝઝૂમી રહેલી મહિલાની સ્થિતિમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. હવે જો તે એક કોકટેલ પણ પીવે છે

તો તેને આલ્કોહોલ પોઈઝનિંગ થવા લાગે છે અને ઘણા દિવસો સુધી માથાનો દુખાવો સહન કરવો પડે છે. રિસર્ચમાં અન્ય વ્યક્તિ વિશે પણ ચોંકાવનારી વાત સામે આવી છે. કોવિડ પહેલા તે તેની ઈચ્છા મુજબ દારૂ પીતો હતો અને તેને કોઈ સમસ્યા થતી નહોતી. હવે માત્ર એક બીયર પીધા પછી માથાનો દુખાવો, ઊંઘની સમસ્યા અને વિચારવામાં તકલીફ થવા લાગે છે. બીજા એક મહિલાને હવે આલ્કોહોલ પીધા પછી ત્વચાની ગંભીર સમસ્યાઓ થવા લાગે છે, જ્યારે પહેલા આવું થતું નહોતું. સંશોધકોએ ઊંડાણપૂર્વકના અભ્યાસ પછી તારણ કાઢ્યું છે કે લાંબા સમય સુધી કોવિડ ચેપથી પીડિત લોકોમાં આલ્કોહોલની પ્રતિક્રિયા અને સંવેદનશીલતામાં ફેરફાર થયો છે. જો શરીરમાં વાયરસ અને ઇન્ફલેમેશન થઈ જાય તો બ્લડ બ્રેઇન બેરિયર નબળો પડવા લાગે છે. આ અવરોધ એ કોષોનું એક સ્તર છે જે ફિલ્ટર તરીકે કામ કરે છે અને મગજને હાનિકારક પદાર્થો, સૂક્ષ્મજંતુઓ અને અન્ય વસ્તુઓથી સુરક્ષિત કરે છે જે નુકસાન પહોંચાડી શકે છે. આ બેરિયર નબળો પડવાને કારણે હવે વધુ દારૂ મગજમાં પ્રવેશી શકે છે અને લોકોને ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકામાં એફ-૧ વિઝા માટે ભારતીયોને વધુ ચાન્સ મળ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ | અમેરિકાના વિઝાની આશા રાખતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પોઝિટિવ સમાચાર આવ્યા છે. વર્ષ ૨૦૨૩માં ભારતીય સ્ટુડન્ટને કુલ ૧.૩૦ લાખ F-1 સ્ટુડન્ટ વિઝા ઈશ્યુ કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૨ની તુલનામાં વિઝાની સંખ્યામાં ૧૪ ટકાનો વધારો થયો છે. એપ્લાયબોર્ડને ટીકીને રિપોર્ટમાં જણાવવામાં છે કે સળંગ બીજા વર્ષમાં અમેરિકાએ બીજા કોઈ પણ દેશના સ્ટુડન્ટ કરતા ભારતીયોને વધારે વિઝા આપ્યા છે.

૨૦૨૨માં કુલ ૪.૧૧ લાખ સ્ટુડન્ટને ૬૧ વિઝા આપ્યા હતા. જ્યારે ૨૦૨૩માં લગભગ ૪.૪૬ લાખ F1 વિઝા આપવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીનો ડેટા જોવામાં આવે તો એક વર્ષની અંદર સુધી વધુ સ્ટુડન્ટને વિઝા આપવામાં આવ્યા છે.



ઈન્ટેલિજન્સ, ઈનોવેશન અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાને પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સનો કોર્સ ભારતીય વિદ્યાર્થીઓ ક્વોલિટી

એજ્યુકેશન અને અલગ અલગ કલ્ચરનો અનુભવ લેવા માટે અમેરિકા જતા હોય છે. F-1 Visa એ નોન-ઈમિગ્રન્ટ વિઝા છે જેનાથી વિદ્યાર્થીઓ અમેરિકન પ્રોવિન્સમાં પ્રવેશી શકે છે અને યુનિવર્સિટી, હાઈસ્કૂલ, એલિમેન્ટરી સ્કૂલ, સેમિનાર, લેંગ્વેજ ટ્રેનિંગ પ્રોગ્રામ અથવા અન્ય એકેડેમિક સંગઠનમાં હાજરી આપી શકે છે. અત્યાર સુધી જે ભારતીય વિદ્યાર્થીઓ પાસે F-1 Visa હતા તેઓ સ્ટેમમાં પોતાનું એજ્યુકેશન પૂર્ણ કર્યા પછી ૧૨ મહિનાની ઓશનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ મેળવી શકે છે. હાથર લેવલ પર પોસ્ટ સેકન્ડરી ડિગ્રી મેળવતી વખતે તેઓ વધુ એક વર્ષના OPTની માંગણી કરી શકે છે. અમેરિકાને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથમ્સનું હબ ગણવામાં આવે છે. અહીં જે

પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળે છે તે બીજા ક્યાંય નથી મળતું. જોકે, અમેરિકામાં એજ્યુકેશન મેળવવું બહુ ખર્ચાળ હોય છે. કેટલાક પ્રોગ્રામની ટ્યુશન ફી ૩૨,૦૦૦ ડોલરથી લઈને ૬૦,૦૦૦ ડોલર સુધી હોય છે. આ ઉપરાંત ભારત કરતા અમેરિકામાં લિવિંગ કોસ્ટ પણ ૨૪૦ ટકા વધારે હોય છે. આવી સ્થિતિમાં સ્ટુડન્ટ પાસે F-1 Visa હોય તો તે ભણવાની સાથે કામ પણ કરી શકે છે. તેના દ્વારા સત્ર ચાલુ હોય ત્યારે દર અઠવાડિયે ૨૦ કલાક કામ કરી શકાય અને રજાઓ હોય ત્યારે સપ્તાહમાં ૪૦ કલાક કામ કરી શકાય છે. આ ઉપરાંત F-1 વિઝા પાંચ વર્ષ માટે વેલિડ હોય છે. આ દરમિયાન સ્ટુડન્ટ પોતાની જરૂરિયાત પ્રમાણે એકેડેમિક પ્રોગ્રામમાં સ્વિચ પણ કરી શકે છે.

ફરી હવામાનમાં આવશે પલટો વરસાદના કારણે ઘઉંની ખેતી કરતાં ખેડૂતોની વધી ચિંતા

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ | માર્ચ મહિનામાં હવામાનમાં અનેક વખત પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલા લઘુત્તમ તાપમાનની ગતિને બ્રેક લાગી શકે છે. ૧૮મી માર્ચથી હવામાન ફરી એકવાર બદલાય તેવી શક્યતા છે. જો કે આ ફેરફારથી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, પરંતુ ઘઉંના પાકને નુકસાન થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. માર્ચના બીજા સપ્તાહમાં હવામાન એકંદરે સ્વચ્છ રહેશે, પરંતુ ૧૯ માર્ચથી પૂર્વીય યુપીના કેટલાક જિલ્લાઓમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે પશ્ચિમ યુપીના જિલ્લાઓ પર કોઈ ખાસ અસર નહીં થાય અને અહીં હવામાન શુષ્ક રહેશે. જો કે પૂર્વ યુપીમાં ૧૯ માર્ચ સુધી હવામાન ગરમ રહેશે, પરંતુ ૧૯ માર્ચ પછી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ૨૦ માર્ચ પણ ઘણી જગ્યાએ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાત્રિના સમયે વધતા તાપમાનનો સામનો કરવા લોકોએ પંખા શરૂ કર્યા છે. ગઈકાલે આગ્રામાં લઘુત્તમ તાપમાન ૧૬.૭, અલીગઢમાં ૧૬.૪, મેરઠમાં ૧૪ અને મુઝફ્ફરનગરમાં ૧૩.૬ નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં માર્ચના ત્રીજા સપ્તાહના અંત સુધીમાં લઘુત્તમ તાપમાન વધીને ૨૦ ડિગ્રી સેલ્સિયસ થઈ જશે, જ્યારે માર્ચના અંતિમ સપ્તાહમાં દિવસનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે.

મોદીની સૂર્ય ઘર યોજના પર પ્રતિક્રિયા અંગે ખુશી વ્યક્ત કરી એક માસમાં ૧ કરોડ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને દેશવાસીઓની પ્રતિક્રિયા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે 'એક્સ' પર લખ્યું કે, 'આ યોજના શરૂ થયાના માત્ર એક મહિનામાં જ ૧ કરોડ પરિવારોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી છે.' રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ ઘરોને મફત વીજળી યોજના તરીકે સૌર ઊર્જા સુવિધા આપવાની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વીજળી તો મળશે જ, પરંતુ ભારત ઊર્જા ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે.



કરાવવું જોઈએ.' પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ દેશમાં રહેતા ગરીબ પરિવારોને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળશે. આ યોજનાનો લાભ ૧ કરોડ પરિવારોને આપવામાં આવશે. આ યોજના હેઠળ રૂકટોપ સોલર સિસ્ટમ લગાવનારા લોકોને સબસિડી આપવામાં આવશે. જો કોઈ પરિવાર આ યોજના હેઠળ ૧ કિલોવોટની રૂકટોપ સોલર સિસ્ટમ લગાવે છે, તો તે વ્યક્તિને ૩૦,૦૦૦ રૂપિયાની સબસિડી, ૨ કિલોવોટ સિસ્ટમ માટે, ૬૦,૦૦૦ રૂપિયા અને ૩ કિલોવોટની સિસ્ટમ માટે, ૭૮,૦૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ યોજના

સંબંધિત અરજીઓ અને શરતો માટે <https://pmsuryaghar.gov.in/> ની મુલાકાત લઈ શકો છો. પીએમ સૂર્ય યોજના હેઠળ જનરેટ થતી વધારાની વીજળી વેચીને વાર્ષિક ૧૭થી ૧૮ હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬ સુધીમાં ૪૦ હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેનારા ગ્રાહકોને વીજળીનું બિલ ઓછું આવશે અને વાર્ષિક ૧૮,૦૦૦ રૂપિયા સુધીની બચત થશે. પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ દેશના તે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મળશે, જેમના પરિવારની વાર્ષિક આવક ૨ લાખ રૂપિયાથી ઓછી છે. આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા લોકો વીજળી ઉત્પાદન માટે તેમની ખાલી છતનો યોગ્ય ઉપયોગ કરી શકે છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગમાં પણ મદદ કરશે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના માટે ડોક્યુમેન્ટ આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ, વીજળીનું બિલ, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઈઝ ફોટો હોવા જોઈએ.

૩૫ વર્ષથી ભક્તિ સંગીત આપનાર અનુરાધા ભાજપમાં જોડાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ | ૮૦ના દાયકાની પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોડવાલની રાજકીય ઈનિંગ શરૂ થઈ ગઈ છે. છેલ્લા ૩૫ વર્ષથી ભક્તિ સંગીત આપતી અનુરાધા ભાજપ માં જોડાઈ. સિંગર અનુરાધા પોડવાલે બીજાની હેડક્વાર્ટર ખાતે શપથ લીધા હતા. બીજાની જાણ કર્યા પછી અનુરાધા પોડવાલને સંગીતના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેમને ચાર વખત ફિલ્મફેર એવોર્ડ અને એક વખત નેશનલ ફિલ્મ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. હું તે પક્ષમાં જોડાઈ રહ્યો છું જેનું સનાતન સાથે ખૂબ જ ઊંડું જોડાણ છે. ભાજપમાં જોડાવું એ મારું સૌભાગ્ય છે. અનુરાધાએ ભાજપના મંચ પરથી સર્વ મંગલ મંગલ નારાયણી નમસ્તે ભજન ગાયું. ગાયિકા અનુરાધા પોડવાલે કહ્યું કે, આજે હું તે લોકો સાથે જોડાઈ રહી છું, જે સરકાર સાથે જોડાઈ રહી છું જેનો સનાતન સાથે આટલો ઊંડો સંબંધ છે અને હું પોતે પણ છેલ્લા ૩૫ વર્ષથી ભક્તિ ગીતો ગાઈ રહી છું. રામમંદિરની સ્થાપના વખતે મને પાંચ મિનિટ ગાવાનો મોકો મળ્યો. જે મારું એક સ્વપ્ન હતું.

બે વર્ષનું એરિયસ ચૂકવવામાં આવશે એલઆઈસીના કર્મચારીઓના પગારમાં તોલિંગ વધારો કરાયો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬ | સરકારે જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની જીવન વીમા નિગમના કર્મચારીઓના પગારમાં ૧૭ ટકાના વધારાને મંજૂરી આપી છે. LIC કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય ૧ ઓગસ્ટ, ૨૦૨૩થી પ્રભાવી ગણવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી LICના લગભગ ૧ લાખ કર્મચારીઓ અને લગભગ ૩૦,૦૦૦ પેન્શનરોને રાહત મળશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ નિર્ણય વિશે માહિતી આપતા LICએ કહ્યું કે કેન્દ્ર સરકારે ૧ ઓગસ્ટ, ૨૦૨૩થી ૧.૧૦ લાખ કર્મચારીઓના પગારમાં ૧૭ ટકાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારાની સાથે LIC કર્મચારીઓને બે વર્ષના પગારનું એરિયસ પણ મળશે. કેન્દ્ર સરકારે ટ્રેજરીમાં યોગદાન એટલે કે LIC કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન ૧૦ ટકાથી વધારીને ૧૪ ટકા કર્યું છે, જે ૧ એપ્રિલ, ૨૦૧૦ના રોજ જોડાયેલા ૨૪૦૦૦ કર્મચારીઓને મોટો ફાયદો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વધારા વધારાથી વાર્ષિક રૂ. ૪૦૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે. એવું કહેવામાં આવ્યું છે કે પગાર વધારો ઓગસ્ટ ૨૦૨૨ થી લાગુ થશે અને ભથ્થા સહિત, પગાર વધારો ૨૨ ટકા સુધી હશે.

મુંબઈની સુકાની હરમનપ્રિતને તેની એક ભૂલ ભારે પડી ગઈ હરમનને ૧૮મી ઓવરમાં જીવનદાન મળ્યું, તેમ છતાં ઓવરના છેલ્લા બોલ પર ફરી જોખમ લેતા આઉટ થઈ

(એજન્સી) મુંબઈ, તા.૧૬ | ડબલ્યુપીએલ ૨૦૨૪ની એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ૫૨મી ઓવરમાં સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં એમઆઈએ પોતાની ઈનિંગ દરમિયાન મજબૂત પકડ બનાવી હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં આરસીબીએ ભાજી પલટી દીધી અને પહેલીવાર ડબલ્યુપીએલ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. મુંબઈ માટે સૌથી મોટું કારણ કેપ્ટન હરમનપ્રીત કોરની વિકેટ હતી. હરમનને ૧૮મી ઓવરમાં જીવનદાન મળ્યું, તેમ છતાં તેણે ઓવરના છેલ્લા બોલ પર ફરીથી જોખમ લીધું અને આઉટ થઈ ગઈ હતી. તેની આ ભૂલ એમઆઈએને ભારે પડી અને આ વિકેટ મેચનો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ૧૩૫ રન બનાવ્યા હતા, આ સ્કોર સામે મુંબઈની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૧૩૦ રન જ બનાવી શકી હતી. હરમનપ્રીત કોરે મેચ બાદ કહ્યું, "અમે ખરેખર સારી બોલિંગ કરી, અમે તેમને ૧૪૦થી ઓછા રનના સ્કોર પર રોકી દીધા. બેટિંગ પણ સારી હતી પરંતુ અમે



છેલ્લા ૧૨ બોલમાં સારી બેટિંગ કરી ન હતી. અમને ૧૨ બોલમાં માત્ર એક બાઉન્ડેરીની જરૂર હતી. તે હાંસલ કરી શક્યા નહીં. આ રમત હંમેશા તમને કંઈકને કંઈક શીખવે છે અને દબાણમાં મૂકે છે, તમારે તેમાંથી શીખવાની જરૂર છે. જ્યારે અમે મારી વિકેટ ગુમાવી હતી, ત્યારે અમારા બેટર પોતાનું સંયમ જાળવી શક્યા ન હતા, તે ટર્નિંગ પોઈન્ટ હતો."

સામે લાવવાનું કામ કરી શકે છે. અમે ખરેખર સખત સંઘર્ષ કર્યો, આ સિઝન અમારા માટે ઉતાર-ચઢાવની રહી, છેલ્લી સિઝનમાં અમે ખરેખર સારું પ્રદર્શન કર્યું પરંતુ અમે ઘણું શીખ્યા અને આશા છે કે આગામી સિઝનમાં અમે સારી તૈયારી કરીશું અને બાઉન્સ બેક કરીશું."

એમઆઈએને છેલ્લી ત્રણ ઓવરમાં માત્ર ૨૦ રનની જરૂર હતી અને ક્રિઝ પર બે સેટ બેટર હતા. ૧૮મી ઓવરમાં જ્યારે રિચા ઘોષે સ્ટ્રિકિંગ કરવાની તક ગુમાવી ત્યારે કોરને જીવનદાન પણ મળ્યું. જો કે શ્રેયંકા પાટીલે પોતાનું સંયમ જાળવી રાખ્યું અને તેના સ્પેલના છેલ્લા બોલ પર હરમનપ્રીતને આઉટ કરી હતી. હરમનપ્રીતની વિકેટ પડતાં રિકેન્ડિંગ ચેમ્પિયન્સ આરસીબી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. છેલ્લી ઓવરમાં ૧૨ રનની જરૂર હોવાથી, મંથાનાએ આશા શોભને બોલિંગ સોંપી અને તેણે પોતાની કેપ્ટનને નિરાશ ન થવા દીધી. તે ગાભરાઈ નહીં અને આરસીબીને જીત તરફ દોરી ગઈ. મુંબઈએ છેલ્લા ૧૮ બોલમાં કોઈ પણ બાઉન્ડેરી ફટકાર્યા વિના માત્ર ૧૪ રન બનાવ્યા હતા.

આજનું રાશિ ભવિષ્ય....

મેષ (અ,વ,ઇ) :
આજના દિવસે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મન:સ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. આજે તમારી સમક્ષ આવતી મુશ્કેલીઓની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો.

વૃષભ (બ,વ,ઇ) :
આજના દિવસે ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. મનોરંજન અથવા કોન્સર્ટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પરિવારના સભ્યો સહકાર આપશે પણ તેમની માગો પણ વધુ હશે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો.

મિથુન (ક,ઇ,ઇ) :
આજના દિવસે ક્રિટનેસ તથા વેટ લોસ પ્રોગ્રામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમારા પરિવારના સભ્યો પ્રત્યે તમારો પ્રભુત્વભર્યા અભિગમને કારણે વિના કારણ દલીલો થરૂ થશે તથા ટીકાઓ પણ સર્જાઈ શકે છે. તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે, તેથી ઘણી વખત તમારા પર ગુસ્સો થશે.

કર્ક (ડ,ઇ) :
આજના દિવસે તમારું ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પરતાવો તમને પછીથી થાય. વેપાર ને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વ પૂર્ણ પગલાં લાવી શકો છો જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે.

સિંહ (મ,ઇ) :
આજના દિવસે તમે જો હાલના સમયમાં હતોત્સાહની લાગણી અનુભવતા હો તો-તમારે યાદ રાખવું જઈએ કે આજે યોગ્ય વિચારો અને વર્તન જરૂરી એવી રાહત લાવશે. રાત્રી ના સમયે આજે તમને નવ લાભ થવા ની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે.

કન્યા (પ,ઇ,ઇ) :
આજના દિવસે તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે ઓળખ સમય મળશે. ગાંધી યોગ્ય વિચારો અને વર્તન આજે તમને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે.

તુલા (ર,ત) :
આજના દિવસે ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઈછીની આપેલી રકમ પરત આપેરે પરત મળશે. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે.

વૃશ્ચિક (ન,ચ) :
આજના દિવસે પાતી-પીતી વખતે ચેતના રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. આજ ના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુ નું સેવન ના કરવું જોઈએ કેમકે નશા ની સ્થિતિ માં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે.

ધન (ભ,ઇ,ફ) :
આજના દિવસે તમારું શારીરિક સાર્થક જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો? ગ્રહ નક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવા ની ઘણી તકો બનશે? બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે.

મકર (બ,જ) :
આજના દિવસે તમારા લાંબા સમયની બીમારીના ઈલાજ માટે સ્મિત થેરેપીનો ઉપયોગ કરજો કેમ કે તે તમામ સમસ્યાની શ્રેષ્ઠ દવા છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે.તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરણ્યો જ ઊભા કરશે.

કુંભ (ગ,શ,સ) :
આજના દિવસે માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે- આથી દંટ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. પૈસા ની અછત આજે ઘર માં વિવાદ નું કારણ બની શકે છે, આવી સ્થિતિ માં તમારા ઘર ના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું કરશે.

મીન (દ,ચ,ઝ,થ) :
આજના દિવસે જીવનને માણવા માટે તમારી ઉમેદો યકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બહાર ફૂંકશે.



ન્યૂઝ ફ્રિફ

કેસર કેરીની રાહ જોવી પડશે બજારમાં આવતા વાર લાગશે

। (એજન્સી) જૂનાગઢ, તા.૧૬ । કેસર કેરીના સ્વાદ રસિકો માટે એક માઠા સમાચાર આવ્યા છે. દર વર્ષે કેસર કેરીની આંબે આવવાની શરૂઆત નવેમ્બર મહિનાથી થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે તાપ માનની ખૂબ વિષમ પરિસ્થિતિને લીધે આંબો રાખનાર ઈજારદારોને પણ ખૂબ મુશ્કેલી વેઠવી પડે, તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. જે ફલાવરિંગ નવેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં આવવું જોઈએ, તે ઉગાવો આ વખતે કેરીમાં પાકમાં દેખાયો જ નથી. અમુક વિસ્તારોમાં વાતાવરણની સારી અસરને લીધે કેરીનો પાક આવ્યો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં તાપમાનની વિષમ પરિસ્થિતિ જોવા મળી છે. નવેમ્બરના અંતથી ડિસેમ્બરની શરૂઆતમાં જે કેરીના મોર આવવા જોઈએ, તે આવ્યો નથી. જાન્યુઆરીમાં પણ આ ફલાવરિંગ નહિવત રહ્યું હતું. ફેબ્રુઆરીમાં વિસ્તાર પ્રમાણે ૩૦ ટકા ૪૦ ટકા અને ૫૦ ટકા ફલાવરિંગ જોવા મળ્યું એટલે અત્યારે વાત કરવામાં આવે તો સરેરાશ ૬૦ ટકા જેવું ફલાવરિંગ દરેક બગીચામાં જોવા મળી રહ્યું છે.

વિજાપુર માર્કેટયાર્ડ ખાતે એરંડાનાં ભાવમાં ઉછાળો

। (એજન્સી) મહેસાણા, તા.૧૬ । વિજાપુર માર્કેટયાર્ડ ખાતે નવી મગફળી અને કપાસની આવક ધમધોકાર થઈ રહી છે. આજ રોજ મગફળીની આવકનો ઘટાડો નોંધાયો હતો સાથે ભાવમાં ઘટાડો નોંધાયો હતો. યાર્ડમાં કપાસની સારી આવક તેમજ ભાવ નોંધાયા હતા. વિજાપુર માર્કેટ યાર્ડમાં આજે રાયડો, બાજરી, ઘઉં, જુવાર, મગ, અડદ અને ગવારની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસના ભાવ ૧૬૫૦ ની ઊંચી સપાટી એ પહોંચ્યા હતા. આજે એરંડાના ભાવ પણ ઉચકાયા હતા. સમગ્ર ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનમાં વિવિધ પાકોનું મબલખ વાવેતર કરવામાં આવે છે. જેમાં મહેસાણા જિલ્લામાં રવિ સીઝનમાં સૌથી વધુ વાવેતર એરંડા તેમજ કપાસનું કરાતું હોય છે. ઉત્તર ગુજરાતમાં આવેલું વિજાપુર માર્કેટયાર્ડ જણસીના વેચાણ માટે એક વિશ્વસનીય સ્થળ બન્યું છે. આ માર્કેટયાર્ડમાં કપાસ, તમાકુ, મગફળી, ઘઉં અને એરંડાની આવક વધારે થતી હોય છે. વિજાપુર માર્કેટયાર્ડ ખાતે ૧૫ માર્ચ નાં રોજ મગફળીની ૪૬૦ બોરી આવક નોંધાઈ હતી.



ગુજરાત સરકાર દ્વારા જીએસઆરટીસીની ૩૦૦ બસનું લોકાર્પણ જીએમડીસી ગ્રાઉન્ડથી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.



વિસ્તારાની વધુ ફલાઈટસ થશે શરૂ હવે અમદાવાથી ગોવા જવા માટે મળશે વધુ ૬ ફલાઈટસ વેકેશનમાં ગોવા ફરવા જતા ટૂરિસ્ટની સંખ્યા વધુ હોવાથી વિસ્તારાએ ગોવાની ડાયરેક્ટ ફલાઈટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

ચાર્ડ ખાતે વિવિધ જાસીઓની આવક નોંધાઈ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો કપાસના ૧,૩૫૧ રૂપિયાથી ૧,૬૦૧ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા, કપાસની ૧,૩૫૧ મણની આવક નોંધાઈ હતી

। (એજન્સી) અમરેલી, તા.૧૬ । અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે સાવરકુંડલા ચાર્ડમાં ૧૫ માર્ચના રોજ મોટી મગફળીના ૧,૨૩૧ રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. કપાસના ૧,૩૫૧ રૂપિયાથી ૧,૬૦૧ રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આજે કપાસની ૧,૩૫૧ મણની આવક નોંધાઈ હતી. ચાર્ડમાં યણાની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ ૧,૦૪૦ રૂપિયાથી લઈને ૧,૨૨૧ રૂપિયા સુધીના બોલાયા હતા. લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ ૪૩૫ રૂપિયાથી લઈને ૫૫૦ રૂપિયા બોલાયો હતો. ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ૪૫૦ રૂપિયાથી લઈને ૬૫૧ નોંધાયો હતો.

હતો. માર્કેટિંગ ચાર્ડમાં ૬,૦૦૦ મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા ચાર્ડમાં સફેદ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ ૨,૫૦૦ રૂપિયાથી લઈને ૨,૬૫૦ રૂપિયા નોંધાયો હતો. માર્કેટિંગ ચાર્ડમાં કાળા તલનો ભાવ ૨,૩૦૦ રૂપિયાથી લઈને ૨,૮૦૦ રૂપિયા સુધી બોલાયા હતા.



લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

। અમદાવાદ, તા.૧૬ । આજથી આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઈ કઈ બાબતોનું પાલન કરવું તે અંગે માહિતી અપાઈ. આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ ૭મી મે-૨૦૨૪ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજનાર છે. જેના માટે આગામી તારીખ ૧૨ એપ્રિલ-૨૦૨૪ના રોજ જાહેરાતમાં બહાર પાડવામાં આવશે. લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવા માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુ શ્રી પ્રવિણા ડી. કે.ના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.



અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આજથી આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઈ કઈ બાબતોનું પાલન કરવું તથા કઈ લોકસભા બેઠકમાં કઈ વિધાનસભા ભેત્રનો સમાવેશ થાય છે તે અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કરે માહિતી આપતાં જણાવ્યું કે ચૂંટણીલક્ષી ફરિયાદો માટે ૨૪ કલાક કંટોળ રૂમ શરૂ કરીને હેલ્પલાઇન નંબર ૧૯૫૦ જાહેર કરવામાં આવ્યો છે અને તેલ શ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૯૬૬ છે. ખર્ચ નિયંત્રણ માટે પણ અલગ અલગ ૬૬ જેટલી ટીમોની રચના કરવામાં આવી આવી છે. રાજકીય પક્ષોને વિવિધ મંજૂરી લેવા માટે આજથી જ સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ બરે સહિત સંબંધિત અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મારી સાથે કેમ મિત્રતા નથી રાખતી કહી ચુપતીની ગાડીનો કાંચ તોડ્યો

। (એજન્સી) અમદાવાદ, તા.૧૬ । શહેરના નરોડા વિસ્તારમાં પારુલ પટેલ પરિવાર સાથે રહે છે અને તેમના પતિ બે વર્ષથી કામ ધંધા માટે અમેરિકા ગયા છે. ૧૫ માર્ચના રોજ પારુલ પોતાની કાર લઈ નરોડા જીઆઈડીસી ખાતે ઉભી હતી. ત્યારે અગાઉનો મિત્ર પ્રથ્વી ઉદયસિંહ ઠાકોર ત્યાં એકટીવા લઈને આવ્યો હતો. પ્રથ્વીએ એકટીવા પરથી ઉતરી પારુલને જણાવ્યું હતું કે, તુ મારી સાથે મિત્રતા કેમ નથી રાખતી ત્યારબાદ બોલચાલ કરવા લાગ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ નરોડા વિસ્તારમાં પારુલ પટેલ પરિવાર સાથે રહે છે અને તેમના પતિ બે વર્ષથી કામ ધંધા માટે અમેરિકા ગયા છે. ૧૫ માર્ચના રોજ પારુલ પોતાની કાર લઈ નરોડા જીઆઈડીસી ખાતે ઉભી હતી. ત્યારે અગાઉનો મિત્ર પ્રથ્વી ઉદયસિંહ ઠાકોર ત્યાં એકટીવા લઈને આવ્યો હતો. પ્રથ્વીએ એકટીવા પરથી ઉતરી પારુલને જણાવ્યું હતું કે, તુ મારી સાથે મિત્રતા કેમ નથી રાખતી ત્યારબાદ બોલચાલ કરવા લાગ્યો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો.

મારા પિતાનું ઓપરેશન કેમ નથી કરતા કહી તબીબને ફટકારનાર સામે ફરિયાદ

। (એજન્સી) અમદાવાદ, તા.૧૬ । શહેરના અસારવા વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલમાં યુવક પહોંચ્યો હતો અને મારા પિતાનું ઓપરેશન કેમ નથી કરતા કહી તબીબને ફટકાર્યો હતો. આ મામલે સિક્કુરીટી ગાર્ડ યુવક સામે શાહિબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. નોંધનીય છે કે, પહેલાં સિક્કુરીટી ગાર્ડે ઊંડાવી યુવકને બહાર કાઢ્યો તો ફરી તબીબ પાસે પહોંચ્યો હતો અને ઝઘડો કર્યો હતો. મૂળ હિંમતનગરના વાવડી ગામે રહેતા ૫૯ વર્ષિય અભેસિંહ ખાતુસિંહ મકવાણા જીઆઈએસએફ સિક્કુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. હાલ તેમની નોકરી આંખની હોસ્પિટલ ખાતે આવેલ ઓપીડીમાં છે. ૧૫મીના રોજ અભેસિંહ પોતાની ફરજ પર હાજર હતા. ત્યારે ઓપીડી રૂમ નંબર ૨૭૧માંથી રેસીડેન્સ ડોક્ટર નિરવ પ્રવિણભાઈ દિયોરા, વિપુલ ચૌધરી સહિતના લોકો પોતાનું કામ કરી રહ્યાં હતા. ત્યારે કુપ્હાનગર ખાતે રહેતો રજત રામનરેશ રાજપુત તેમના પિતા રામનરેશને લઈ ડો. નિરવ પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમે મારા પિતાનું ઓપરેશન કેમ નથી કરતા અને ધક્કા ખવડાવો છો. ત્યારબાદ આ મામલે બોલચાલ થતા અભેસિંહ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને તેમને ઓપીડીની બહાર લઈ ગયા હતા તથા મામલો થાળે પાડ્યો હતો. જો કે, બપોરે ફરીથી રજત રાજપુત ત્યાં આવ્યો હતો અને ડો. નિરવ બીજાની ફાઇલ ચેક કરી રહ્યાં હતા. ત્યારે તેમની પાસે જઈ તમે કેમ મારા પિતાનું ઓપરેશન નથી કરતા કહી ગાળો બોલી લાકો મારી દીધો હતો. ગુસ્સે ભરાયેલ રજતે ડોક્ટરને ગળદાપાટુનો માર પણ માર્યો હતો. આ સમયે બુમાબુમ થતા બીજા તબીબ સહિતના લોકો એકત્ર થઈ ગયા હતા અને તેમને ઊંડાવા પ્રયાસ કર્યા હતા.

ખેડાના ગળતેશ્વરમાં પડાલ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી

। (એજન્સી) ખેડા, તા.૧૬ । રાજ્યમાં ફરી એક વાર જૂથ અથડામણની ઘટના બની છે. ખેડાના ગળતેશ્વરમાં પડાલ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. નમાજ પઢવાને લઈને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. રમજાન માસની નમાજ અદા કરવા માટે માથાકૂટ થઈ છે. રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર જૂથ અથડામણની ઘટના બની છે. ખેડાના ગળતેશ્વરમાં પડાલ ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. નમાજ પઢવાને લઈને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું. રમજાન માસની નમાજ અદા કરવા માટે માથાકૂટ થઈ છે. બંને જૂથ સામે સામે આવી જતા પથ્થર મારો થયો છે.

પડધરી પંચકમાં જીજ્ઞાના દરોડા રાજકોટમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો

। (એજન્સી) રાજકોટ, તા.૧૬ । રાજકોટમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના પડધરીના ખજૂરડી ગામે SMCNA દરોડા પાડ્યા છે. ખજૂરડી ગામમાં બુટલેગરે ફાર્મ હાઉસમાં ડારુનો ઝડપાયો છે. વોન્ટેડ ચંપક ઉર્ફે ડીગો વેકરિયાના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યા છે. રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. ત્યારે રાજકોટમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના પડધરીના ખજૂરડી ગામે SMCNA દરોડા પાડ્યા છે. ખજૂરડી ગામમાં બુટલેગરે ફાર્મ હાઉસમાં ડારુનો ઝડપાયો છે. વોન્ટેડ ચંપક ઉર્ફે ડીગો વેકરિયાના ફાર્મ હાઉસમાં દરોડો પાડ્યા છે. અલગ અલગ ડારુનો જથ્થો ઝડપાયો છે. તેમજ ૧૩ લાખ રૂપિયાની ૫૦૮૮ દારુની બોટલ જપ્ત કરવામાં આવી છે. આ અગાઉ અમદાવાદમાં દારુનો જથ્થો ઝડપાયો હતો. અમદાવાદમાં વોશિંગ મશીનની આડમાં દારુની હરાફેરીનો ખુલાસો થયો હતો. PCBએ લાખોનો દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ૧૦૨ વોશિંગ મશીનમાં ૭૫૦૦ દારુની બોટલો છુપાવી હતી. ટૂંક, દારૂ સહિત ૫૪ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. દારુની હરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

MAMTA SOLUTION House Keeping નો કોન્ટ્રાક્ટ લેવામાં આવે છે, House Keeping સવાચ દરીએ છીએ. લેબર કોન્ટ્રાક્ટ કરીએ છીએ લેબર જોતા હોય તો કોલ કરો કોઈ પણ કંપનીને લેબરની જરૂરીયાત હોય તો કોલ કરો. લેબર (લેડીઝ/જેન્ટલ) છોકરાઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. લેબરને તમામ પ્રકારની ફેસિલીટી આપવામાં આવે છે, જેવી કે મેડેકલ/ખાવા-પીવાનું/રહેવાનું આપવામાં આવે છે. 88 66 21 7393

જાનકી ટ્રેડર્સ FinOlex PIPES NIKANTH STEEL JK SUPER CEMENT. નેહલ મહેતા M :- 97261 06200 nehalmeheta81.nm@gmail.com સીમેન્ટ, ટીએમટી લોખંડ, એગલ, પાઈપ્સ, પતરા વગેરે દરેક જાતનું બીલ્ડિંગ મટીરીયલ્સ અમારા ત્યા વ્યાજબી ભાવે મળશે... અવશ્ય મુલાકાત લો... ગજા સિનેમા પાસે, પ્રતાપપુરા, ઉખરેલી રોડ, સંતરામપુર, જિલ્લા-મહિસાગર

ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત દૈનિક સમાચાર પત્ર. છુપાડો ફોન 9800708900 આ નંબર પર માત્ર વોટ્સએપ મેસેજ જ કરવો. આપની આસપાસ બનતી ઘટનાઓના ફોટાઓ વીડીઓ મોકલી આપો દરેક જાતના પ્રસંગ, ઉમંગ, શાળાઓ, કોલેજોથી લઈને સોસાયટીઓ સુધી અવસરથી લઈને તહેવારો સુધી બધા જ સમાચારોને આપરી લેતુ અખબાર “ચેનલ નાઈન નેટવર્ક ગુજરાત” દૈનિક હંમેશા તૈયાર રહે છે, આપની આસપાસ બનતી રસપ્રદ ઘટનાઓની માહિતી વોટ્સએપ નંબર ઉપર અથવા ઈ-મેઈલ પર અમને લખીને મોકલો... cningujarat@gmail.com